

Date: August 13, 2024

To, General Manager (Listing), BSE Limited, PhirozeJeejeebhoy Towers, Dalal Street, Fort, Mumbai - 400001, Maharashtra, India

Company Script Code: 540063

Subject: Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015

Dear Sir/Ma'am,

In Compliance with Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulation 2015, please find enclosed herewith the newspaper advertisement for the Un-audited Standalone Financial Result for the quarter ended June 30, 2024 published in the "Lokmitra" in Gujarati language and "Free Press" in English language containing extract of unaudited Financial Results as per regulation 33 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Kindly take the same in your record.

Thanking You,



NILAM VIREN MAKWANA COMPANY SECRETARY & COMPLIANCE OFFICER

Encl: As attached

ECS Biztech Ltd. Regd. Office: The First, B-02, ECS Corporate House, Behind Keshavbaug Party Plot, Off. 132 ft Ring Road, Vastrapur, Ahmedabad- 380015. Gujarat. India. Phone: 8980005006 / 8980004000 | Web: www.ecscorporation.com CIN: L30007GJ2010PLC063070

FREE PRESS GUJARAT

PM Modi's expected visit to Ukraine: Data protection is a bigger part of our lives **Rhetoric and reality** continue to lose money in considered as the "black gold" collected, processed



conflict would soon touch the Union. 900-day mark, with no end in sight. It bears repeating that this nation of 38 million people has fallen victim to the ambition, rivalry and machinations of big powers. Ukraine's only fault was to take Western assurances at face value and turn its back on Russia. It has paid and price for its strategic naivety.

Ukraine has lost a minimum of 31,000 military personnel and more than 11,000 civilians (exact figures are unknown and likely to be much higher). A far larger number lie wounded, many grievously. An estimated 6.5 million people have fled the country, and 3.7 million people have been internally displaced. Reportedly, 14.6 million people will need humanitarian assistance this year. Ukraine's infrastructure is in a shambles, the power grid has been crippled, and close to 20 per cent of its territory is now under Russian control. More than half of Ukraine's 36-gigawatt power generation capacity has been wrecked, causing huge shortages and blackouts. Despite importing 2GW of power from the EU, setting up mini-power plants, and using generators, the dire situation is likely to become grimmer during the upcoming severe winter season. It would take hundreds of billions of dollars and at least a generation to rebuild. It is doubtful that the requisite resources for doing so would be made available by Ukraine's affluent friends, even though they have eagerly supplied huge quantities of military hardware and munitions to fight the Russian army. It is sad and ironic that were simultaneously waging countries, rich and poor, readily find resources to wage war but not to further peace or devel\$2 trillion. Imagine what a transformation such a quantum of funds would have brought about, had they been deployed for combating hunger, disease, and climate change! Since the beginning of the conflict in February 2022, the US alone has provided approximately \$53.7 billion in military assistance and hardware to Ukraine, including tanks, artillery, rockets, helicopters, UAVs, air defence batteries, and armoured personnel carriers. An estimated \$93 billion in aid (military and civil) has been

The ruinous Ukraine committed by the European

Yet Ukraine is asking for more and pressing for advanced weaponry to take the fight deeper into Russian territory. NATO has since agreed to equip Ukraine with sixty F-16 fighter jets. The induction process has begun. Not satisfied, President Volodymyr Zelenskyy has been continues to pay a very heavy urging NATO to remove all restrictions on the calibre and usage of Western weapons against Russia.

example of Putin.

dodging is growing.

questions.

overseas visit by the Indian

prime minister gets known

sustained

NATO is divided over the issue, with some sections fearing, and rightly so, that such a move could lead to a marked escalation in conflict. The consequences of poking Russia, which possesses the largest number of nuclear weapons, in the eye could be extremely dangerous. The West also knows that in the event of a flare-up, it would essentially fall on them to pick up the pieces.

Ukraine has every right to defend itself and has done so admirably despite the heavy odds. But it has also shown an adventurous streak in carrying out stealth and provocative operations against Russia without taking NATO into confidence. According to the New York Times, such operations that have 'frustrated' and 'unnerved' American officials include a strike on a Russian air base on the western coast of Crimea, a truck bombing that destroyed part of the Kerch Strait Bridge, which links Russia to Crimea, and drone strikes deep inside Russia.

It may sound fanciful, yet a real possibility existed of ending the conflict within 100 days. According to insider accounts, Russia and Ukraine war and talking peace,

Editor : Mayur Bhatt

treaty were exchanged in only a few days in advance. March and April 2022 that Given the serious security Given the serious security envisaged a peace deal challenges, one wonders how premised on a neutral Ukraine it has become public almost a month before the event. that would forsake NATO membership but could Typically, prospectively become a confidential complete confidentiality is maintained in such situations, and the visit In turn, the five permanent is announced a few hours members of the UN Security ahead or even after its Council plus Germany, Italy, conclusion. Secondly, why is Poland, Israel, and Turkey were to provide multilateral the visit being contemplated at such a juncture? India's ties security guarantees to Ukraine. Zelenskyy and Putin with Ukraine are cordial but not necessarily substantive. An were slated to meet face-to-Indian prime minister has not visited Ukraine for decades. face to sort out differences and conclude the treaty. India has traditionally looked However, it was allegedly at the country through the scuttled primarily by the UK prism of her ties with Russia. and the US, who were Ukraine since independence has had a Westward determined to make an orientation. Ukrainian supplies Notwithstanding

of military hardware to а Western Pakistan, exceeding a billion dollars, rankled with India. disinformation campaign about President Vladimir Pakistan, notwithstanding Putin's declining health and official denials, has since fading support, he is going reciprocated by supplying 155mm artillery shells worth strong. The Russian economy \$364 million to Ukraine in remains robust. Its war 2022–23. Since the outbreak machinery is chugging along. It is the Western attention and of the conflict, Narendra Modi commitment that is faltering! and Volodymyr Zelenskyy have After some 30 months of met twice on the margins of hostilities, the Ukrainian G7 summits and have also had morale is getting affected, several telephone conversations. India has sent and the incidence of draftat least 15 consignments of

Meanwhile, an estimated humanitarian assistance to 450,000 Russian and over Ukraine. Kyiv was quite helpful in facilitating the safe evacuation of Indian students. 200,000 Ukrainian troops are engaged in a bitter fight with missiles flying in all directions, Ukraine has sought Indian wreaking havoc on life and intervention to end the conflict. property. It is in such a fraught It has similarly reached out to atmosphere that Prime several other nations, Minister Narendra Modi could including China. At the same be visiting Ukraine in late time, Kyiv has been quite critical of India's stand on the August. It gives rise to several conflict. The Ukrainian foreign First and foremost is that minister had remarked that of security. Even under normal "every barrel of the Russian oil India receives contains a conditions, news of an

blood".

MEHTA INTEGRATED FINANCE LIMITED CIN: L65910GJ1985PLC007692 Regd. Office : 003, Law Garden Apart. Scheme-1, Opp. Law Garden Ellisbridge, Ahmedabad - 380006. Phone No. +91 79 26561000, E-mail : Mifl_in@yahoo.co.in, Website: www.mehtaintegratedfinance.com Extract of Statement of Standalone Un-audited Financial Results for the 1st quarter ended 30th June, 2024 (Rs. In Lacs 3 Months Preceding Corresponding Year ended ended 3 Months 3 Months 31st March Sr. PARTICULARS 30th June ended 31st ended in the 2024 No. March, 2024 2024 previous yea 30th June, 2023 (Unaudited) (Audited) (Audited) (Unaudited)

20.37



Vinod Chandrashekhar Dixit Free-lance Journalist, Writer & Cartoonist

(dixitpatrakar@yahoo.in)

Privacy is one of the most urgent issues associated with information technology and digital media. People should protect their privacy, control their digital footprint and escalate the protection of privacy and data as priority. It serves as a timely reminder for organisations about the importance of correctly handling and safeguarding individuals' personal data. It is led by the National Cyber Security Alliance, a non-profit, public private partnership focused on cyber security education for all online citizens. Internet banking frauds

and ways to avoid them is undoubtedly a topic that has been done to death. And yet, people across country

such frauds with an alarming frequency. Today computer and internet has become very common and necessary for our daily life. Back in 1990, less than 1 lakh people were able access Internet worldwide. Now around 2.5 million people are hooked up to surf the net around the globe

The internet brings joy to our lives but at the same time it has some negative sides too. The cyber criminals are always in a search to find out the new ways to attack the possible internet victims. New generation is growing up with computers and most important is that all the monetary transactions are moving on to the internet. So, it has become very important for us to be aware of the various Cyber Frauds being committed with the help of computers. The Cyber Frauds today are on rise and the latest & perhaps the most complicated problem in the cvber world. According to a survey, for every 500 Čyber Frauds, only 50 get reported to the police, and just one out of this 50 is registered as an FTR

of tomorrow, in particular because it enables companies to better address the market needs. There are many individuals who are generally unfamiliar about the risks related to the protection of their personal data and of their rights in this respect. It is well known fact that most of the citizens all over the world are unaware about their rights in relation to data protection while some people are breaching data protection

laws unknowingly on a daily

basis. According to an Internet and Mobile Association of India report, India has around 400 million Internet users. Data protection is a bigger part of our lives. But, often we ignore its importance. We come across data protection issues at work, when browsing the internet, when dealing with public authorities, when we shop, when we book tickets online and in many other circumstances. Whether data is stored on premise or with an external private or public cloud provider, organisations should assess and reassure both employees and Personal data is now customers that data is

accessed, shared, stored, transferred and secured in accordance with all laws and regulations, and that data is only being used in pre-agreed, legitimate and lawful ways.

There's no doubt that Data Protection Day serves as a timely reminder for organisations about the importance of correctly handling and safeguarding individuals' personal data.

Maintaining of data bases is not as much difficult task as maintaining its integrity, so in this era the most concerned debate is going on to innovate a perfect method of data protection. Raising awareness of, and compliance with, data protection and privacy across the organisation must not be seen as an exercise that can be satisfied once a year. It requires ongoing committed activity from everyone within the organisation, from the top down/bottom up. It is the very big headache for the business houses, financial institutions and the governmental bodies so as to give adequate protection to their huge databases. (B-15 Jyoti-Kalash Society, Jodhpur Tekra, Śatellit Ahmedabad - 380 015) Śatellite,

Rajkot ST section to charge 1/4 times fare

50 extra buses to Ahmedabad, Surat, Bhavnagar, Bhuj, Godhra, Dahod on Janmashtami, new Somnath route launched


Rajkot, In Rajkot, people are seeing great enthusiasm for the Janmashtami festivities. A Janmashtami Lok Mela is going to be held in the race Raj course grounds from 24th to 28th August. Apart from this, other fairs are also to be held in Saurashtra. In which the people of Saurashtra including Rajkot will take more advantage of traveling to ST. substantial share of Ukrainian Because, at this time the fares

of private buses will be
doubled. So, extra buses will
be run in Rajkot, Morbi and
Surendranagar denote by
Surendranagar depots by Rajkot ST Division. So that
passengers including working
class will be able to travel
cheaply and safely on ST.New
route of Somnath started
Rajkot ST Divisional Director J.
B. Karotra said that extra buses
are being operated from Ghela
Somnath to Rajkot, Rajkot to
Somnath and Veraval since the
beginning of Shravan month.
Jasdan to Ambaji Bus has been
started by Rajkot ST Division.
Buses from Jasdan to Dwarka,
Wankaner to Dwarka, Morbi to

Ahmedabad and Halwad to reaches us, the bus route Santarampur and from Ahmedabad to Mandvi in ??Kutch have also been started. New routes have been launched keeping in mind the needs of the passengers.

Along with this, he said that more than 50 extra buses will be started in the future keeping in view the Janmashtami festivals. In which additional buses will be started on the seventh and eighth festivals in view of the rush of passengers from Rajkot to Ahmedabad, Somnath, Dwarka, Bhuj and Bhavnagar. Apart from this, if

going there will be started. People from UP, Bihar are working in construction site, food and beverage in Rajkot city. Besides, Bengali artisans work in Soni Bazar while laborers from Godhra-Dahod live here and earn their living. Also people from Amreli work as diamond cutters in Surat. All these people ride cheap ST buses to their hometowns. Then extra buses are run by the ST department so that these people do not have to face the crowd in the ST buses. However, passengers are



facilitated by Belarus and Turkey. Several drafts of a

AMC OF ELECTRONIC INTERLOCKING SYSTEM The Divisional Railway, Manager (S&T) western Railway, Bhavnagar invite e tenders on behalf of President of India for the following works. (i) Tender No: 15-2024 Bhavnagar Division: Comprehensive Annual Maintenance Contract of Electronic Interlocking System of KYOSAN make for a period of Three years at Somnath station in Junagadh - Somnath section Estimate Cost : 4909267.11/-(Rs. Forty Nine Lakhs Ninety Two Thousand Sixty Hundred Sever and Eleven Paisa Only) The bidders have to apply on line through link i.e www.ireps.gov.in only for further detai please visit web site <u>www.ireps.gov.in</u> Last date for on line apply 06/09/2024 up to 15.00 Hrs. Like us on: f facebook.com/WesternRl

WESTERN RAILWAY - BHAVNAGAR DIVISION

AXIS BANK LIMITED (CIN: L65110GJ1993PLC020769)

Structured Assets Group at Corporate Office, at 7 Floor, "Axis House", C-2, Wadia Intee Centre, Pandurang Budhkar Marg, Worli, Mumbai - 400025. <u>www.axisbank.com</u>

POSSEESSION NOTICE (For Immoveable Property) [As per Appendix IV read with Rule 8(1) of the Security Interest (Enforcement) Rules, 2002]

Whereas,

The undersigned being the authorized officer of the Axis Bank Ltd., under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice dated 31.05.2023 calling upon the Borrower/Guarantors/Mortgagor viz., P K Transmission Products Private Limited, Pravin Kishorkumar Jain, Prabha Pravinbhai Jain, Vishal Pravinbhai Jain, Harsh Pravinkumar Jain and Sheetal Harshkumar Jain, to repay the amount mentioned in the notice being Rs.7, 19,84, 164.07/- (Rupees Seven Crore Nineteen Lakh Eighty Four Thousand One Hundred Sixty Four and Paise Seven) being the amount due as on 30.04.2023 with further interest from 01.05.2023 at the contractual rate thereon till the date of payment; within 60 days from the date of the said Notice. The physical possession of the mortgaged property described herein below is taken by respected Court

Commissioner, on 11.08.2024 in accordance with order passed by the Hon'ble Hon'ble Additional Chief Judicial Magistrate, on application filed under section 14 of the SARFAESI Act i.e. CRMA No.14138 of 2023 by Axis Bank Ltd. and thereafter the physical possession of the mortgaged property described herein below is handed over by respected Court Commissioner, on the same day i.e. 11.08.2024 to the Authorised Officer of Axis Bank Limited.

The Borrowers/Guarantors/Mortgagor mentioned herein above in particular and the public in general are hereby cautioned not to deal with the subject property and any dealings with the said properties will be subject to the charge of the Axis Bank Ltd., for an amount of being Rs.7,19,84,164.07/- (Rupees Seven Crore Nineteen Lakh Eighty Four Thousand One Hundred Sixty Four and Paise Seven) for P K Transmission Products Private Limited being the amount due as on 30.04.2023 with further interest thereon from 1.04.2023. cost. etc.

The Borrower's/Guarantors/Mortgagor's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets. DESCRIPTION OF THE IMMOVABLE PROPERTIES

1.All that pieces and parcels of immovable property of Shop No.1 admeasuring 232 Sq. Ft. on Ground Floor along with the mezzanine floor admeasuring 405 Sq. FL of Scheme Known As "Ekta Complex", of The Shreyash Owners Association, lying and situated at City Survey No. 4626 of Mouje: Kalupur-I of Taluka: City of Ahmedabad District in the name of Shri Pravin Kishorkumar Jain.

2.All that pieces and parcels of immovable property of Shop No. 7 admeasuring 48 Sq. Ft. and Shop No. 8 admeasuring 57 Sq. Ft. on Ground Floor, along with Mezzanine Floor admeasuring 405 Sq.ft of Scheme Known As "Ekta Complex", of The Shreyash Owners Association, lying and situated at city survey No. 4626 of Mouje: Kalupur-I of Taluka: City of Ahmedabad District in the name of Shri Pravin Kishorkumar Jain

3.All that pieces and parcels of immovable property of Shop Cellar on Mezzanine floor admeasuring 656 Sq. Ft. and 500 Sq. Ft. of Scheme Known As "Ekta Complex", of The Shreyash Owners Association, lying and situated at city Survey No. 4626 of Mouje: Kalupur- I of Taluka: City of Ahmedabad District in the name of Shri Pravin Kishorkumar Jain.

4.All that pieces and parcels of immovable property of Shop No.21 admeasuring 57 Sq. Ft. on Mezzanine Floor of Scheme Known As "Ekta Complex", of The Shreyash Owners Association, lying and situated at City Survey No. 4626 of Mouje: Kalupur- I of Taluka : City of Ahmedabad District in the name of Smt. Prabha Pravinbhai Jain. Date: 11/08/2024 Place: Ahmedabad Sd/-, Authorized officer Axis Bank Ltd

2 .	Total Expensnes	18.85	13.37	16.16	56.05
3.	Net profit / (loss) for the period (before tax, exceptional and / or extraordinary items)	1.51	117.51	-2.07	154.39
4.	Net profit / (loss) for the period before tax (after exceptional and / or extraordinary items)	1.51	117.51	-2.07	154.39
5.	Net profit / (loss) for the period after tax (after exceptional and / or extraordinary items)	1.51	117.51	-2.07	154.39
6.	Total comprehensive income for the period for the period (after tax)	1.51	117.51	-2.07	154.39
7.	Paid up equity share capital	500	500	500	500
8.	Reserve (excluding revaluation reserve)	0	0	0	1148.68
9.	Earning per share (of Rs. 10/- each) Basic and Diluted	0.03	2.35	-0.041	3.09

Place : Ahmedabad

Place: Ahmedabad

Date: 12.08.2024

Date : 12.08.2024

Total Income

(1). The above is an extract of the detailed format of Un-audited Financial Results for the 1st quarter ended 30th June. 2024 field with Stock Exchange under regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015.

(2). The full format of the same alongwith the note is available on the website of stock exchange at www.bseindia.com and at the website of the Company at : www.mehtaintegrated finance.com

For, Mehta Integrated Finance Limited Sd/-

Vishwesh D. Mehta Managing Director, DIN : 00484785

210.44

Place: Ahmedabad Date: 12th August, 2024

ECS Biztech Limited CIN : L30007GJ2010PLC063070

Registered Office : B-02, THE FIRST, ECS Corporate House, Behind Keshavbaug Party Plot, Off 132 Ft. Road, Vastrapur, Ahmedabad - 380015, Gujarat. Phone : +91-8980005048 || E-mail : secretarial@ecscorporation.com || Website: www.ecsbiztech.com

Extract of Un-audited Standalone Financial Results for the Quarter ended on 30th June, 2024 (Rs. In Lakhs)

			Sta	ndalone	
Sr.	Particulars		Year Ended		
No.		30-06-2024	31-03-2024	30-06-2023	31-03-2024
		Un-audited	Audited	Un-audited	Audited
1	Total Income from operations	170.34	49.48	42.44	215.93
2	Other Income	0.35	0.05	2.31	2.66
3	Total Income (1+2)	170.70	49.53	44.75	218.59
4	Profit before Exceptional Items and Tax	6.64	2.57	1.59	9.69
5	Profit before Tax	6.64	2.57	1.59	9.69
6	Net Profit for the period	6.64	273.81	1.59	280.93
7	Total Comprehensive income for the period	-			
8	Paid-up Equity Share Capital (Face value of Rs. 10/- each per Share)	2,055.50	2,055.50	2,055.50	2,055.50
9	Earnings Per Share (EPS) of Rs. 10/- each (Not Annualised)				
	1. Basic (Rs.)	0.03	1.33	0.01	1.37
	2. Diluted (Rs.)	0.03	1.33	0.01	1.37

Notes:

2

Date: 1

Place: Al

The above Un-audited Standalone financial results for the Quarter ended 30th June, 2024 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in their respective meetings held on 12th August, 2024 and the Limited Review of the same has been carried out by the Statutory Auditors of the Company

The above is an extract of the detailed format of Standalone Un-audited Financial Results for the Quarter ended on 30th June, 2024 filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of the Un-audited Standalone Financial Results for the Quarter ended on 30th June, 2024 are available on the Stock Exchange website: www.bseindia.com and on the Company's website: www.ecsbiztech.com.

For and on behalf of the Board
For ECS Biztech Limited
Sd/-
Vijay M. Mandora
Managing Director (DIN: 00328792)

MEHTA SECURITIES LIMITED CIN: L67120GJ1994PLC022740 Reg. Off: 2, Law Garden Appartment, Scheme-1, Opp. Law Garden, Ellisbridge, Ahmedabad – 380006

| E-mail : mehtasec@yahoo.co.in | Website: www.mehtasecurities.com Ph: 079-26561000

Extract of Statememt of Standalone Un-audited Financial Results for the 1st quarter ended 30th June,2024

Sr.	Particulars	- ··		Corresponding 3	Lakhs except EPS) Year ended 30th
No.	Particulars	3 months ended 30th June,2024	Preceding three months ended 31st March, 2024	months ended in the previous year	March, 2024
		(Un-audited)	(Audited)	(Un-audited)	(Audited)
1	Total income	3.79	8.22	1.15	26.10
2	Total Expensnes	10.46	19.99	9.95	40.92
2	Net profit / (loss) for the period (before tax, exceptional and / or extraordinary items)		-11.78	-8.8	-14.82
3	Net profit / (loss) for the period before tax (after exceptional and / or extraordinanc items)	-6.67	-11.78	-8.8	-14.82
4	Net profit / (loss) for the period after tax (after exceptional and / or extraordinary items)	-6.67	-11.78	-8.8	-14.82
5	Total comprehensive income for the period for the period (after tax)	-6.67	-11.78	-8.8	-14.82
6	Paid up equity share capital	308.94	308.94	308.94	308.94
7	Reserve (excluding revaluation reserve)	0	0	0	229.58
8 Note:	Earning per share (of Rs. 10/-each) Basic and Diluted	-0.22	-0.38	-0.28	-0.48

1)The above is an extract of the detailed format of Un-audited Financial Results for the guarter ended 30th June, 2024 field with Stock Exchange under regulation 33 of the SEBI(Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. 2)The full format of the same alongwith the note is available on the website of stock exchange at www.bseindia.com and at the vebsite of the Company at www.mehtasecurities.com

For, Mehta Securities Limited SD/

Bhavna D. Mehta Chairperson & Managing Director (DIN: 01590958)

otal Comprehensive income for the period [Comprising rofit/(Loss) for the period (after tax) and other (157.28 (202.60 (238.80 (872.02 mprehensive Income (after tax)] aid up Equity Share Capital (Face value of Rs. 10/- each) 833.9 833.97 833.9 833.9 ther Equity 579.3 arnings per equity share (of Rs. 10/- each) (not annualised (a) Basic (in Rupees): (1.89 (2.67 (2.84)(10.38 (b) Diluted (in Rupees) (1.89)(2.67)(2.84)(10.38

Additional information on Standalone Financial Results is as follow

				(Rs. In Lakhs)
	Q	uarter Ended		Year Ended
Particulars	30-06-2024	31-03-2024	30-06-2023	31-03-2024
	(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)
Income from Operations	2374.35	2389.13	2451.79	9522.74
Profit/(Loss) before tax	(156.25)	(207.94)	(233.93)	(841.11
Profit/(Loss) after tax	(156.25)	(207.94)	(233.93)	(841.11
Total Comprehensive income for the period [Comprising	(156.03)	(210.33)	(233.07)	(840.89
Profit/(Loss) for the period (after tax) and other				
Comprehensive Income (after tax)]				

The above is an extract of the detailed format of the Unaudited Standalone & Consolidated Financial Results for the quarter ended 30th June, 2024 filed with Bombay Stock Exchange ("BSE") under Regulation 33 of SEBI (Listing Obligations a Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Standalone & Consolidated Financial Results for the quarter ended 30th June, 2024 is available on the BSE website i.e. www.bseindia.com and also on the website of th Company i.e. www.geotexelin.com

The above results have been reviewed by the Audit Committee of the Directors and approved by the Board of Directors a eir respective meetings held on 12th August, 2024

 For Texel Industries Limited
Sd/-
Shailesh Mehta
Managing Director
DIN: 01457666

લોકમિત્ર, LOKMITRA



૧૩૦થી વધારીને હવે ૧૬૦ કિમી પ્રતિ કલાક કરવામાં આવશે પરંતુ

પ્રાપ્ત ડિટેલ્સ અનુસાર મુસાફરીના નવા શેડ્યૂલમાં મુંબઈથી અમદાવાદ સૌથી મોટો સવાલ થાય કે શું સ્પીડ આવતી વંદે એક્સપ્રેસ ટ્રેન હવે મુંબઈ વધશે તો ટિકિટના ભાવ પણ વધશે કે સેન્દ્રલથી બપોરે ૩ઃ૪૫ વાગ્યે એઆઈ અને રોબોટિક્સમાં પથદર્શક ઈનોવેશન્સ બતાવવા માટે

ઓટોમેશન પર સાઉથ એશિયાનો સૌથી વિશાળ એક્સપો



અમદાવાદ. ઓટોમેશન ઉદ્યોગ સ્ટાર્ટઅપ્સ અને સ્થાપિત ઉદ્યોગના માટે ભારતનું સૌથી મોટું પ્રદર્શન આગેવાનોનો સમાવેશ ધરાવતી ઓટોમેશન એક્સપોએ ૧૭મા નવીન ટેકનોલોજીઓ અને ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ સમાધાનનો વ્યાપક નજરિયો કોન્ફરન્સ પરથી પડદો ઊંચક્વો. આ મુલાકાતીઓને પ્રદાન કરશે. ભારતનું સીમાચિહનરૂપ ઈવેન્ટ ૨૧-૨૪ ઔદ્યોગિક ઓટોમેશન ક્ષેત્ર વૃદ્ધિને પંથે ઓગસ્ટે બોમ્બે એક્ઝિબિશન સેન્ટર છે, જે ૨૦૨૯ સુધી ૧૫ અબજ ડોલર (બીઈસી), નેસ્કો, મુંબઈ ખાતે પરથી ૨૯.૫ અબજ ડોલર સુધી યોજાશે. આ પ્રદર્શન ભારતના ઓટોમેશન ઉદ્યોગમાં ઝડપી વૃદ્ધિ અને ઈનોવેશન દર્શાવવા માટે નોંધપાત્ર સિદ્ધ છે.

ઓટોમેશન એક્સપો ૨૦૨૪ પ્રોસેસ અને ફેક્ટરી ઓટોમેશન પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અને રોબોટિક્સના પરિવર્તનકારી પ્રભાવને આલેખિત કરશે. પારંપરિક રોબો તેમનું ખર્ચ કિફાયતીપશું અને પ્રોગ્રામેબિલિટી માટે લાંબા સમયથી પ્રચલિત છે. જોકે પ્રોડકશન ડેટા સાથે એઆઈને જોડવાથી ઓટોમેશન નવી ઊંચાઈએ પહોંત્યું છે, પ્રેડિક્ટિવ મેઈનટેનન્સમાં પ્રગતિ આવી છે, મટીરિયલ વેસ્ટ ઓછું થયું છે અને ડિમાન્ડ ફોરકાસ્ટિંગ બહેતર બન્યું છે. આ વર્ષનું પ્રદર્શન એમએસએમઈ ક્ષેત્રને ઈનોવેટિવ

પ્રત્યેક રૂ. ૧નો ૧ બોનસ ઇક્વિટી શેર) જે શેરધારકોની મંજૂરીઓને આધીન રહેશે. કંપનીએ ૩૦ જૂન, ૨૦૨૪ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ઓછું જોખમ, સોનાની શુદ્ધતા અને અનુકુળતા, ડિજિટલ

તેજસ અને શતાબ્દી એક્સપ્રેસ જેવી નિઝામુદ્દીન-મુંબઈ સેન્ટ્રલ ઓગસ્ટ આગમન થશે ૨૦:૧૪ વાગ્યે પ્રસ્થાન પર્શ કરી શકાશે. આમ ૪ કલાકનો સમય બચશે. મહત્વની વાત એ છે આ અંગે નવું ટાઈમ ટેબલ પણ જારી

> કરી શકે છે અને અમુક ટ્રેનોના રૂટ લાંબા અથવા ફ્રિકવન્સી વધી શકે છે.

હેઠળ ટ્રેક અપગ્રેડેશનને કારણે તમામ પ્રીમિયમ ટ્રેનો ૧૬૦ કિમીની ઝડપે દોડશે પરંતુ આનાથી ભાડા પર કોઈ થશે જે અગાઉ ૨૦:૧૬ અને અસર નહીં થાય. ઝડપ વધવાથી ૨૦:૧૯ હતા તથા અમદાવાદ અગાઉના ૨૧ઃ૨૫ના આગમનને સ્થાને ૨૧ઃ૧૫ વાગ્યે આગમન થશે. દોડાવી શકાશે.

મળતી માહિતી મુજબ, રેલવે વિભાગે પશ્ચિમ ઝોન રેલવેને ૧૫ ઓગસ્ટથી આ સ્પીડ લિમિટને લાગુ કરવા સૂચના આપી છે. રેલવે બોર્ડે પશ્ચિમ રેલવેના અધિકારક્ષેત્ર હેઠળના મુંબઈ-અમદાવાદ અને મુંબઈ-નાગદા રૂટ પર ૧૫ ઓગસ્ટથી ૧૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો આવશે. ટ્રેનોની સ્પીડ વધારવા માટે દોડાવવાની યોજના તૈયાર કરી છે. એક સંપૂર્શ સૂચિત પ્રક્રિયાનું પાલન આ માટે રેલવે બોર્ડે ઝોનલ રેલવે કરવું પડશે. આમાં ટ્રેક, સિગ્નલ હેઠળના તમામ સંબંધિત વિભાગોના સિસ્ટમ, ઓવરહેડ સાધનો, ટ્રેનના **કઇસ્ને** બ્લોક અને એસએન્ડટી/ કોચ અને એન્જિનને અપગ્રેડેશનનો ટીઆરડી ટીમો પાસેથી જરૂરી કામ સમાવેશ થાય છે.

પૂર્ણ કરાવવા અને સુરક્ષા-સલામતી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતુ. આ પ્રક્રિયા પર્જાથવા હવે લીલીઝંડી મળી.પશ્ચિમ રેલવેના અધિકારીઓનું કહેવું છે કે ટ્રેનોને ૧૬૦ કિમી સુધી ચલાવવા માટે તમામ તૈયારીઓ પૂર્શ થઈ ગઈ છે. મુંબઈ-અમદાવાદ રૂટ, મુંબઈ-વડોદરા રૂટ, વડોદરાથી દાહોદ અને દાહોદથી નાગદા રૂટને ૧૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે અપગ્રેડ કરવામાં આવ્યા છે. આ રૂટ પર નવી ટેકનોલોજીથી સર્ક્ષ સિગ્નલિંગ અને ઓવરહેડ ઈક્વિપમેન્ટ લગાવવામાં આવ્યા છે. આ રૂટ પરથી અનેક રેલ અવરોધો પણ દૂર કરવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે આ ટ્રેનોમાં સ્લીપર ડેન્સિટી વધારવામાં

પહોંચવાની ધારશા છે. (૧-૭) આવી છે. કવચ ટેક્નોલોજી પશ એક્સિટા કોટન લિમિટેડે ૧ઃ૩ના રેશિયોમાં બોનસ ઇશ્યૂની જાહેરાત કરી

અમદાવાદ, ભારતમાં આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની કપાસની ગાંસડીઓ, કપાસના બીજ અને સુતરાઉ યાર્નના નિકાસકારોના અગ્રણી ઉત્પાદકોમાંની એક એક્સિટા કોટન લિમિટેડે ૧ઃ૩ના ગુણોત્તરમાં બોનસ ઇક્વિટી શેર ઇશ્યૂ કરવાની જાહેરાત કરી છે (એટલે કે રેકોર્ડ તારીખે દરેક ૩ ફુલ્લી પેઇડ-અપ ઇક્વિટી શેર માટે

AXITA COTTON ગાળાના નાશાંકીય પરિશામો પશ

જાહેર કર્યા છે. કંપનીએ નાણાંકીય વર્ષ ૨૦૨૫ના પહેલા ત્રિમાસિક ગાળા માટે રૂ. ૩.૫૪ કરોડનો ચોખ્ખો નકો નોંધાવ્યો છે જયારે કરવેરા પહેલાનો નફો રૂ. ૪.૯૬ કરોડ હતો. નાણાંકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં

દોડવાના સમયમાં પણ ફરક પડશે, જેના કારણે અનેક રૂટ પર નવી ટેનો ભારતીય રેલવે મિશન રફ્તાર હેઠળ એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોની ઝડપ વધારવા માટે કામ કરી રહી છે. આ સાથે ગુડ્સ ટ્રેનોની સ્પીડ પણ વધારવામાં આવશે. મિશન રફ્તાર હેઠળ આ તમામ ટ્રેનોની સરેરાશ ઝડપને વધુ વધારવામાં

Google દર મિનિટે કમાય છે ર કરોડ!

આજે આપશે કોઈપણ સવાલનો મફ્તમાં પ્રદાન કરે છે. પરંતુ, તેમ જવાબ શોધવો હોય તો તુરંત જ છતાં ગૂગલ અબજો રૂપિયાની કમાણી જવાબ આપે છે. ત્યાં સુધી કે આપશે કોઈ રસ્તો શોધી રહ્યાં હોઈએ તો એ છેક આપણને તે સ્થળ સુધી મુકવા કે લેવા આવે છે અર્થાત્ ગુગલ આપણને દરેક બાબતમાં મદદ કરે છે. પણ શું તમે જાશો છોકે, ગુગલ તો આપણને બધી જ સેવાઓ ફ્રીમાં એટલેકે, સાવ મફતમાં આપે છે તો ગુગલ કેવી રીતે કમાણી કરે છે, અને કેટલી કમાણી કરે છે. જવાબ જાણીને તમે પણ ચોંકી જશો .ર્યેન્નજ્ઞી એ વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન છે. લોકો કોઈપણ વસ્તુ વિશે જાણવા માટે ગૂગલનો ઉપયોગ કરે છે.

આપણે ગુગલ સર્ચ કરતા હોઈએ કરે છે. એક રિપોર્ટ અનુસાર, ગુગલ છીએ. ગૂગલ આપશાં દરેકનો એવો દર ૧ મિનિટે ૨ કરોડ રૂપિયા કમાય મિત્ર છેકે, જે એક પણ રૂપિયો લીધો છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગુગલ વિના આપણને દરેક સવાલનોના આટલા પૈસા કેવી રીતે કમાય છે? તેની આવકના સ્રોત શું છે? ચાલો તમને જણાવીએ કે ગૂગલ કઈ રીતે પૈસા કમાય છે. ગૂગલની આવકનો સૌથી મોટો સ્રોત જાહેરાત છે. જ્યારે તમે ર્ય્લન્ની પર કંઈપણ સર્ચ કરો છો. ત્યારે તમને ટોચ પર કેટલીક જાહેરાતો દેખાય છે. કંપનીઓ આ જાહેરાતો માટે ગૂગલને ચૂકવશી કરે છે. ગૂગલને આનાથી ઘણા પૈસા મળે છે. આ સિવાય યુટ્યુબ પર જાહેરાતો પશ બતાવવામાં આવે છે, જેમાંથી ગૂગલને ઘણી કમાણી થાય છે. ગૂગલની કેટલીક સેવાઓ પણ ચૂકવવામાં આવે છે. તેનો વિશ્વભરમાં તેના યુઝર્સની સંખ્યા ઉપયોગ કરવાના બદલામાં,



Place : Ahmedabad

Date : 12.08.2024

ખાનગી સંધિદ્વારા સરફેસી એક્ટ, ૨૦૦૨ ની _ જોગવાઇઓ હેઠળ વેચાણ માટેની મિલકત

માથી આઈડીએફસી ફર્સ્ટ બેંક લી.ના અધિકૃત અધિકારીએ સિક્યુરીટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શીયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (ધ સરફેસી એક્ટ ૨૦૦૨)ના ૧૩(૪) હેઠળ મિલકતનો કબ્જો લીધો છે, **તમામ ભાગ અને હિસ્સો ઓફ ફ્લેટ નં. ૩૦૩, ૩જો માળ, માપ ૬૦૦** સ્કેવર ફિટ, (સુપર બિલ્ટ-અપ એરિયા) અને ૩૯૩ સ્કેવર ફિટ , (બિલ્ટ-અપ એરિયા, સાથે અવિભાજીત શેર ૪મીન ઓફ રોડ અને સી.ઓ.પી. જે અંબિકા ટાઉન શીપ બિલ્ડિંગ/ટૉવર નં. જી-૨ જે રેવેન્યુ સર્વે નં. ૮૩/૧, બ્લોક નં. ૧૨૧, ટાઉન પ્લાનિંગ સ્ક્રીમ નં. ૬૯ (ગોડાદરા ડિંડોલી), ઓરીજનલ પ્લોટ નં. ૧૦૯ અને ફાયનલ પ્લોટ નં. ૧૦૯ અને ફાયનલ પ્લોટ નં. ૧૦૯ ઓફ મૌજે ડિંડોલી, સિટી ઓફ સુરત (ગુજરાત)માં સ્થિત છે. અને તેની ચારે બાજુ

		મંત્રીમંડળે ભ	મારતીય રેલવેમ	ાંઆઠનવી લ	નાઇન પ્રોજેક્ટ્સન્	ì	
કનેક્ટિવિટી	પ્રદાન કર	વા. મસાક	રીમાં સરળત	। साववा	લોજિસ્ટિક્સ	ખર્ચ ઘટાડવા,	ઓઇલની
						કરવા મંજૂરી	
આપાત	વદાડમાં ચ	ાગ ઝાબગ	ગવારલાઇ	Sal Gran	ગતના વડાગ	उरपा मथूरा	ઔપ

નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ રેલવે મંત્રાલયની આઠ (૮) પરિયોજનાઓને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ અંદાજિત ખર્ચ રૂ. ૨૪,૬૫૭ કરોડ (અંદાજે) છે. નવી લાઇનની દરખાસ્તો સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે અને ગતિશીલતામાં સુધારો કરશે, જે ભારતીય રેલવે માટે કાર્યક્ષમતા અને સેવાની વિશ્વસનીયતામાં વધારો કરશે. આ વિવિધ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નવા ભારતનાં વિઝનને અનુરૂપ છે, જે આ વિસ્તારનાં લોકોને રોજગારી/ સ્વરોજગારીની તકોમાં વધારો

અમદાવાદ, પ્રધાનમંત્રી શ્રી કરવા માટે વિસ્તૃત વિકાસનાં માધ્યમથી 'આત્મનિર્ભર' બનાવશે. સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે, જે છ (૬) મહત્વાકાંક્ષી જિલ્લાઓ આ પ્રોજેક્ટ્સ મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી માટે પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનનં મલ્કાનગિરી, પરિશામ છે, જે સંકલિત આયોજન મારફતે શક્ય બન્યું છે અને લોકો, ૫૧૦ ગામડાઓ અને આશરે ૪૦ લાખની વસતિને કનેક્ટિવિટીમાં ચીજવસ્તુઓ અને સેવાઓની અવરજવર માટે સાતત્યપૂર્શ વધારો કરશે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ અજંતા ગુફાઓને કનેક્ટિવિટી પ્રદાન કરશે. સાત ભારતીય રેલવે નેટવર્ક સાથે રાજ્યો એટલે કે ઓડિશા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઝારખંડ, બિહાર, જોડવામાં આવશે, જેથી મોટી તેલંગાશા અને પશ્ચિમ બંગાળનાં ૧૪ જિલ્લાઓને આવરી લેતી ૮ મળશે. કૃષ્િ પેદાશો, ખાતર, ડાયોકસાઇડનાં ઉત્સર્જનમાં ઘટાડો (આઠ) યોજનાઓથી ભારતીય કોલસો, લોખંડની કાચી ધાતુ, (૦.૮૭ મિલિયન ટન) એમ બંનેમાં રેલવેનાં હાલનાં નેટવર્કમાં ૯૦૦ સ્ટીલ, સિમેન્ટ, બોક્સાઇટ, ચૂનાના મદદ કરશે, જે ૩.૫ કરોડ વૃક્ષોનાં કિલોમીટરનો વધારો થશે. પત્થરો, એલ્યુમિનિયમ પાવડર, વાવેતરને સમકક્ષ છે.

આ યોજનાઓ સાથે ૬૪ નવા ગ્રેનાઇટ. બેલાસ્ટ. કન્ટેનર વગેરે જેવી ચીજવસ્તુઓના પરિવહન માટે આ આવશ્યક માર્ગો છે. ક્ષમતા (પૂર્વ સિંઘબુમ, ભદાદ્રી કોઠાગુડેમ, વધારવાનાં કાર્યોને પરિશામે ૧૪૩ એમટીપીએ (મિલિયન ટન પ્રતિ નબરંગપુર, રાયગડા), અંદાજે વર્ષ) ની તીવ્રતાનો વધારાનો નૂર પરિવહન થશે. રેલવે પર્યાવરણને અનુકૂળ અને પરિવહનનું ઊર્જાદક્ષ માધ્યમ છે, જે આબોહવાનાં લક્ષ્યાંકો હાંસલ કરવામાં અને દેશનાં લોજિસ્ટિક્સ ખર્ચને લઘુતમ કરવામાં, ઓઇલની આયાત (૩૨.૨૦ કરોડ સંખ્યામાં પ્રવાસીઓને સુવિધા લિટર) ઘટાડવામાં અને કાર્બન


MEHTA INTEGRATED FINANCE LIMITED CIN: L65910GJ1985PLC007692

કાલાહાંડી,

Regd. Office : 003, Law Garden Apart. Scheme-1, Opp. Law Garden Ellisbridge, Ahmedabad - 380006. Phone No. +91 79 26561000, E-mail : Mifl_in@yahoo.co.in, Website: www.mehtaintegratedfinance.com

Sr. No.	PARTICULARS	3 Months ended 30th June, 2024	Preceding 3 Months ended 31st March, 2024	Corresponding 3 Months ended in the previous year 30th June, 2023	Year ended 31st March 2024
		(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)
1.	Total Income	20.37	130.88	14.09	210.44
2.	Total Expensnes	18.85	13.37	16.16	56.05
3.	Net profit / (loss) for the period (before tax, exceptional and / or extraordinary items)	1.51	117.51	-2.07	154.39
4.	Net profit / (loss) for the period before tax (after exceptional and / or extraordinary items)	1.51	117.51	-2.07	154.39
5.	Net profit / (loss) for the period after tax (after exceptional and / or extraordinary items)	1.51	117.51	-2.07	154.39
6.	Total comprehensive income for the period for the period (after tax)	1.51	117.51	-2.07	154.39
7.	Paid up equity share capital	500	500	500	500
8.	Reserve (excluding revaluation reserve)	0	0	0	1148.68
9.	Earning per share (of Rs. 10/- each) Basic and Diluted	0.03	2.35	-0.041	3.09
Note (1). (2).	The above is an extract of the detailed format of Un-audite with Stock Exchange under regulation 33 of the SEBI (Listin The full format of the same alongwith the note is available of website of the Company at : www.mehtaintegrated finance	g Obligations & on the website o	Disclosure Requ of stock exchan	uirements) Regulatio	ons, 2015. a.com and at th

Vishwesh D. Mehta, Managing Director, DIN : 00484785



	કંપનીની કુલ આવક રૂ. ૧૫૪.૯૬				૪, માંગીલાલ પ્રજાપતિ અને		3 Net Profit/(Loss) for the period after tax 4 Total Comprehensive income for the period [Comp	rising	(157.50)	(222.65)	(236.46)	(866.05)
ગોલ્ડમાં ભારતીયોની રુચિ વધારશેઃ નવી સર્વે	કરોડ અને એબિટા રૂ. પ.૭૩ કરોડ			પ૯૭૫૫ સંદર્ભમા (સુરક્ષિતવિ			Profit/(Loss) for the period (after tax) and other	ising .	(157.28)	(202.60)	(238.80)	(872.02)
ગાલ્ડમાં ભારતાવામાં રંગય વેવારરા, ગેવા રાવ	રહી હતી. પહેલા ત્રિમાસિક ગાળામાં			પત્તિની ખરીદી માટે સંભવિલ			Comprehensive Income (after tax)] 5 Paid up Equity Share Capital (Face value of Rs. 10/-	each)	833.97	833.97	833.97	833.97
અમદાવાદ, ડિજિટલ ગોલ્ડ એ રોકાણ કર્યું કારણ કે સોનાએ				ધેકારી કલમ ૮ અને ૯ સિક્યુ			6 Other Equity		000.07		000.07	579.30
એક અનોખી ઓફર છે જે ગ્રાહકોને તાજેતરના ભૂતકાળમાં સારું વળતર	કંપનીની કામગીરી અંગે એક્સિટા કોટન			ા ઉપરોક્ત મિલકતના વેચાણ	ાની નોટિસ આપી રહ્યા છે.		7 Earnings per equity share (of Rs. 10/- each) (not an	nualised)				
	લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ	મિલકત "જ્યાં છે તે પ્રગ	નાશે છે અને તે જ પ્રમાશે છે"	વેચાણ માટે રહેશે.			(a) Basic (in Rupees): (b) Diluted (in Rupees):		(1.89)	(2.67)	(2.84)	(10.38) (10.38)
આધુનિક અને્ નવીન સ્વરૂપમાં આપ્યું છે. ૨. ડિજિટલ સોનું = ચોરીનું	ડિરેક્ટર શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું	ગિરો મિલકત નું	તમામ ભાગ અને હિસ્સે	. ઓફ ફ્લેટનં. ૩૦૩, ૩જા મ	માળે,માપ ૬૦૦ સ્કેવર ફિટ,		(b) Dilutea (in Rupees): tes:		(1.89)	(2.67)	(2.84)	(10.38)
પરંપરાગત એસેટ ક્લાસમાં રોકાશ જોખમ નહીં- ૩૯% માને છે કે ઘરે	હતું કે ''ઉદ્યોગની પડકારજનક સ્થિતિ	📔 🚽 મરનામં 🕺 (સુપર બિલ્ટ-અપ એરિયા) અને ૩૯૩ સ્કેવર ફિટ (બિલ્ટ-અપ એરિયા) સાથે					1 Additional information on Standalone Financial Res	ults is as follows:				(Rs. In Lakhs)
કરવા સક્ષમ બનાવે છે. નવી દ્વારા ફિઝીકલ સોનું રાખવા કરતાં ડિજિટલ	અને વૈશ્વિક સુસ્તી છતાં મજબૂત			ત ઓફ રોડ અને સી.ઓ.પ					Quar	ter Ended		Year Ended
ડિજિટલ ગોલ્ડના રોકાશકારો અને સોનું ઓછું જોખમી છે- ચોરીની ચિંતા				જે રેવેન્યુ સર્વે નં.૮૩/૧, બ્લો			Particulars		30-06-2024 3 Unaudited)	1-03-2024 (Audited)	30-06-2023 (Unaudited)	31-03-2024 (Audited)
બિન-રોકાશકારો વચ્ચે હાથ ધરાયેલો નથી. ૩. સૌથી શુદ્ધ સોનું ખરીદવાનો	ત્રિમાસિક પરિષ્ટામો જાહેર કરતા			.ડિંડોલી), ઓરીજનલ પ્લોટનં ૧ પ્લોટ નં.૧૦૯ ઓફ મૌજે			Income from Operations		2374.35	2389.13	2451.79	9522.74
તાજેતરનો અભ્યાસ ભારતમાં તેને સંતોષ- ૩૬% લોકોએ 'ડિજિટલ	અમને આનંદ થાય છે. કેન્દ્ર સરકાર			ા ગ્લાટ ન.૧૦૯ આરુ નાજ ોની ચારે બાજુ : પુર્વે : ફ્લેટનં.			Profit/(Loss) before tax Profit/(Loss) after tax		(156.25) (156.25)	(207.94)	(233.93) (233.93)	(841.11) (841.11)
	નવા બજારોમાં પ્રવેશ મેળવવા માટે		:- રોડ અને દક્ષિણે :- ફ				Total Comprehensive income for the period [Comp	rising	(156.03)	(210.33)	(233.07)	(840.89)
્રબૂપનાવવાના મુખ્ય કારશો અને ગોલ્ડ'માં તેના શુદ્ધતાના પાસા એટલે કે	તમામ શક્ય પ્રયાસો કરી રહી છે.	અનામત કિંમત	રૂા. રં	૩૦૦૦૦૦/- (રૂપિયા ત્રણ લ	ાખ પુરા)		Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]					
ડિજિટલ ગોલ્ડેને વ્યાપકપણે ૨૪-કેરેટ શુદ્ધ સોનું ખરીદવાની	ભારતીય કાપડ ઉદ્યોગ એ દેશના મુખ્ય	ખાનગી સંધિની		૩૦- ઓગષ્ટ- ૨૦૨૪		1	2 The above is an extract of the detailed format of the above is an extract of the detailed format of the above is an extract of the detailed active back and a second a					
અપનાવતા અટકાવતા કેટલાક ક્ષમતાને કારણે રોકાણ કર્યું છે. ૪.		હરાજી તારીખ					ended 30th June, 2024 filed with Bombay Stock Disclosure Requirements) Regulations, 2015. The fi		. –			
અવરોધો પર પ્રકાશ પાડે છે. નવી ડિજિટલ સોનું વધુ અનુકૂળ છે - ૨૫%				ધી ડિમાન્ડ નોટિસમાંદ ઓગણીસ હજાર બ સો			the quarter ended 30th June, 2024 is available of Company i.e. www.geotexelin.com	n the BSE website	e i.e. www.bse	india.com a	and also on th	ne website of the
દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાંથી ટકા લોકોને ડિજિટલ ગોલ્ડ ઑફર કરતી	unten ett isen arei om ett ig	રૂ.૧૧૧૯૨૧૮.૬૫ પગો વ્યાજ અને આ	/-(રાપવા અગ્વાર લાખ નયાંગિક ખર્ચ સાથે ૩૦-૨	ં આગણાસ હજાર ખસા મોગષ્ટ-૨૦૨૪ પહેલા ચૂક	અઢાર અને પાસઠ પસા વવા માટે ગ્રચિત કરવામાં		3 The above results have been reviewed by the Au	lit Committee of	the Directors a	and approve	ed by the Boa	rd of Directors at
	પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખી રહી	સુરા), ગ્યા કગાય ગય આવે છે. જો તેમ ન શ	પુરાત્વક વરસાવ 00 વ પ્રાય તો ખાનગી સંધિ દ્વાર	ા મિલકત વેચવામાં આવશે	નના નાટ સૂન્યત કરવાના		their respective meetings held on 12th August, 202	4.			For Texel Indu	strios Limitod
ડિજિટલ ગોલ્ડમાં રોકાણ માટેના ઍપદ્વારા કોઈપણસમયે ડિજિટલ ગોલ્ડ	ເດັດໃດ ໄດ້ເປັນ ເປັນ ເປັນ ເປັນ ເປັນ ເປັນ ເປັນ ເປັນ				સહી/-						:	Sd/-
ટોચના કારણો નીચે મુજબ છેઃ ૧. રોકાણને ખરીદવા, વેચવાની અને ટ્રેક		નારીખઃ૧૩.૦૮.૨૦૨ જોયા ૨૨૨૨	X		અધિકૃત અધિકારી	Pla	ce: Ahmedabad					sh Mehta ng Director
સોનું = સારું વળતર- ૫૦% લોકોએ 🛛 કરવાની સગવડ પસંદ છે. ★	(11 41 45 18(41 44. (12 4)	સ્થળ : સુરત		આ	ઈડીએફસી ફર્સ્ટ બેંક લીમીટેડ		te : 12th August, 2024					1457666
	MEHT	SECUR	ITIES LI	MITED			ECC Bi	toch I	imitad	1		
પ્રણવ અદાણીએ જણાવ્યો ધારાવીની			1994PLC022740					ztech L		•		
પ્રકાર અદાજાાએ જ શાબ્ધા પારાપામાં	Reg. Off: 2, Law Garden Appartme				abad - 380006		Registered Office : B-02, THE FIRST, ECS Corpo	007GJ2010P		haura Party	Plot Off 1	32 Ft Road
_	E-mail : mehtase	:@vahoo.co.in	Website: www.m	ehtasecurities.com	abau - 300000		Vastrapur, Ahmedabad - 38					52 H. Rodu,
કાયાકલ્પનો 'માસ્ટર પ્લાન' !			-26561000				E-mail : secretarial@ecscorp					
	Extract of Statememt of Standalone	Jn-audited Fina	ncial Results for t	•	ed 30th June, 2024	E	Extract of Un-audited Standalone Financi	al Results for	r the Quart	er ended	d on 30th	June, 2024
્રુઅમદાવાદ,એશિયાની સૌથી હતું કે, ''અનેક પડકારો હોવા છૃતાં				<u>`</u>	Lakhs except EPS)		1			Standalone	0	(Rs. In Lakhs)
મોટી સ્લમ ધારાવીના પુનઃવિકાસની અદાણી જૂથ સાત વર્ષની	Sr. Particulars	3 months	Proceeding three	Corresponding 3	Year ended 30th	Sr.			Quarter en	Standalone ded	e	(Rs. In Lakhs) Year Ended
	Sr. Particulars No.	3 months ended 30th	Preceding three months ended	<u>`</u>		Sr. No.	Particulars	30-06-2024	-	ded		Year Ended
મોટી સ્લમ ધારાવીના પુનઃવિકાસની અદાણી જૂથ સાત વર્ષની યોજના સમયસર પૂર્ણ કરવા અંગે સમયમર્યાદામાં એશિયાની સૌથી		ended		Corresponding 3 months ended in	Year ended 30th	Sr. No.		30-06-2024 Un-audited	31-03-202 Audited	ded 4 30-0 Un-a	06-2023 audited	Year Ended 31-03-2024 Audited
મોટી સ્લમ ધારાવીના પુનઃવિકાસની અદાણી જૂથ સાત વર્ષની યોજના સમયસર પૂર્શ કરવા અંગે સમયમર્યાદામાં એશિયાની સૌથી અદાણી ગ્રૂપે ખાસ યોજના બનાવી મોટી ઝૂંપડપટ્ટીનો કાયાકલ્પ		ended 30th	months ended	Corresponding 3 months ended in the previous year	Year ended 30th	1	Total Income from operations	Un-audited 170.34	31-03-202 Audited 49.	4 30-0 Un-a	06-2023 audited 42.44	Year Ended 31-03-2024 Audited 215.93
મોટી સ્લમ ધારાવીના પુનઃવિકાસની અદાેણી જૂથ સાત વર્ષની યોજના સમયસર પૂર્ણ કરવા અંગે સમયમર્યાદામાં એશિયાની સૌથી અદાણી ગ્રૂપે ખાસ યોજના બનાવી મોટી ઝૂંપડપટ્ટીનો કાયાકલ્પ છે. અદાણી ગ્રૂપના ડિરેક્ટર પ્રણવ કરવાનો વિશ્વાસ ધરાવે છે". ૪૬-		ended 30th June,2024	months ended 31st March, 2024 (Audited)	Corresponding 3 months ended in the previous year 30th June, 2023	Year ended 30th March, 2024 (Audited)	1	Total Income from operations Other Income	Un-audited 170.34 0.35	31-03-202 Audited 49. 0.	4 30-0 Un-a 48 05	06-2023 audited 42.44 2.31	Year Ended 31-03-2024 Audited 215.93 2.66
મોટી સ્લમ ધારાવીના પુનઃવિકાસની અદાણી જૂથ સાત વર્ષની યોજના સમયસર પૂર્શ કરવા અંગે સમયમર્યાદામાં એશિયાની સૌથી અદાણી ગ્રૂપે ખાસ યોજના બનાવી મોટી ઝૂંપડપટ્ટીનો કાયાકલ્પ છે. અદાણી ગ્રૂપના ડિરેક્ટર પ્રણવ કરવાનો વિશ્વાસ ધરાવે છે". ૪૬- અદાણીએ ધારાવીના કાયાકલ્પ વર્ષીય ઉદ્યોગપતિ પ્રણવ અદાણીએ	No.	ended 30th June,2024 (Un-audited)	months ended 31st March, 2024 (Audited) 8.22	Corresponding 3 months ended in the previous year 30th June, 2023 (Un-audited)	Year ended 30th March, 2024 (Audited) 26.10	1	Total Income from operations Other Income Total Income (1+2)	Un-audited 170.34	31-03-202 Audited 49.	ded 4 30-0 Un-a 48 05 53	06-2023 audited 42.44	Year Ended 31-03-2024 Audited 215.93
મોટી સ્લમ ધારાવીના પુનઃવિકાસની અદાશી જૂથ સાત વર્ષની યોજના સમયસર પૂર્શ કરવા અંગે સમયમર્યાદામાં એશિયાની સૌથી અદાશી ગ્રૂપે ખાસ યોજના બનાવી મોટી ઝૂંપડપટ્ટીનો કાયાકલ્પ છે. અદાશી ગ્રૂપના ડિરેક્ટર પ્રશવ કરવાનો વિશ્વાસ ધરાવે છે". ૪૬- અદાશીએ ધારાવીના કાયાકલ્પ વર્ષીય ઉદ્યોગપતિ પ્રશવ અદાશીએ કરવાની યોજના અંગે ખાસ માહિતી બ્લૂમબર્ગ સાથેની વિશેષ વાતચીત	No. 1 Total income 2 Total Expensives Net profit / (loss) for the period (before)	ended 30th June,2024 (Un-audited) 3.79 10.46 re	months ended 31st March, 2024 (Audited) 8.22	Corresponding 3 months ended in the previous year 30th June, 2023 (Un-audited) 1.15	Year ended 30th March, 2024 (Audited) 26.10	1 2 3	Total Income from operations Other Income Total Income (1+2) Profit before Exceptional Items and Tax	Un-audited 170.34 0.35 170.70	31-03-202 Audited 49. 0. 49. 2.	ded 4 30-0 Un-a 48 05 53	06-2023 audited 42.44 2.31 44.75	Year Ended 31-03-2024 Audited 215.93 2.66 218.59
મોટી સ્લમ ધારાવીના પુનઃવિકાસની અદાણી જૂથ સાત વર્ષની યોજના સમયસર પૂર્શ કરવા અંગે સમયમર્યાદામાં એશિયાની સૌથી અદાણી ગ્રૂપે ખાસ યોજના બનાવી મોટી ઝૂંપડપટ્ટીનો કાયાકલ્પ છે. અદાણી ગ્રૂપના ડિરેક્ટર પ્રણવ કરવાનો વિશ્વાસ ધરાવે છે". ૪૯- અદાણીએ ધારાવીના કાયાકલ્પ વર્ષીય ઉદ્યોગપતિ પ્રણવ અદાણીએ કરવાની યોજના અંગે ખાસ માહિતી બ્લૂમબર્ગ સાથેની વિશેષ વાતચીત આપી હતી. અદાણી ગ્રૂપના ચાર ઇનસાઇડ અદાણીમાં જણાવ્યું હતું કે	No. 1 Total income 2 Total Expenses Net profit / (loss) for the period (befter tax, exceptional and / or extraordinal tax	ended 30th June,2024 (Un-audited) 3.79 10.46	months ended 31st March, 2024 (Audited) 8.22 19.99	Corresponding 3 months ended in the previous year 30th June, 2023 (Un-audited) 1.15 9.95	Year ended 30th March, 2024 (Audited) 26.10 40.92	1 2 3 4	Total Income from operations Other Income Total Income (1+2) Profit before Exceptional Items and Tax	Un-audited 170.34 0.35 170.70 6.64	31-03-202 Audited 49. 0. 49. 2.	ded 30-0 Un-3 Un-3 48	D6-2023 audited 42.44 2.31 44.75 1.59	Year Ended 31-03-2024 Audited 215.93 2.66 218.59 9.69
મોટી સ્લમ ધારાવીના પુનઃવિકાસની અદાશી જૂથ સાત વર્ષની યોજના સમયસર પૂર્શ કરવા અંગે સમયમર્યાદામાં એશિયાની સૌથી અદાશી ગ્રૂપે ખાસ યોજના બનાવી મોટી ઝૂંપડપટ્ટીનો કાયાકલ્પ છે. અદાશી ગ્રૂપના ડિરેક્ટર પ્રશવ કરવાનો વિશ્વાસ ધરાવે છે". ૪૬- અદાશીએ ધારાવીના કાયાકલ્પ વર્ષીય ઉદ્યોગપતિ પ્રશવ અદાશીએ કરવાની યોજના અંગે ખાસ માહિતી બ્લૂમબર્ગ સાથેની વિશેષ વાતચીત	No. 1 Total income 2 Total Expensives Net profit / (loss) for the period (before)	ended 30th June,2024 (Un-audited) 3.79 10.46 re ry -6.67	months ended 31st March, 2024 (Audited) 8.22	Corresponding 3 months ended in the previous year 30th June, 2023 (Un-audited) 1.15	Year ended 30th March, 2024 (Audited) 26.10	1 2 3 4	Total Income from operations Other Income Total Income (1+2) Profit before Exceptional Items and Tax Profit before Tax	Un-audited 170.34 0.35 170.70 6.64 6.64	31-03-202 Audited 49. 0. 49. 2. 2.	ded 30-0 Un-3 Un-3 48	D6-2023 audited 42.44 2.31 44.75 1.59 1.59	Year Ended 31-03-2024 Audited 215.93 2.66 218.59 9.69 9.69
 મોટી સ્લમ ધારાવીના પુનઃવિકાસની અદાશી જૂથ સાત વર્ષની યોજના સમયસર પૂર્શ કરવા અંગે સમયમર્યાદામાં એશિયાની સૌથી અદાશી ગ્રૂપે ખાસ યોજના બનાવી મોટી ઝૂં પડપટ્ટીનો કાયાકલ્પ છે. અદાશી ગ્રૂપના ડિરેક્ટર પ્રશવ કરવાનો વિશ્વાસ ધરાવે છે". ૪૯- અદાશીએ ધારાવીના કાયાકલ્પ વર્ષીય ઉદ્યોગપતિ પ્રશવ અદાશીએ કરવાની યોજના અંગે ખાસ માહિતી આપી હતી. અદાશી ગ્રૂપના ચાર ઉત્તરાધિકારીઓ પૈકી એક પ્રશવ "અમે પ્રોજેક્ટનો વિરોધ કરનાર 	No. 1 Total income 2 Total Expenses Net profit / (loss) for the period (before tax, exceptional and / or extraordina tax, exceptional and / or extraordina times)	ended 30th June,2024 (Un-audited) 3.79 10.46 re re re -6.67 re	months ended 31st March, 2024 (Audited) 8.22 19.99 -11.78	Corresponding 3 months ended in the previous year 30th June, 2023 (Un-audited) 1.15 9.95	Year ended 30th March, 2024 (Audited) 26.10 40.92	1 2 3 4	Total Income from operations Other Income Total Income (1+2) Profit before Exceptional Items and Tax Profit before Tax Net Profit for the period Total Comprehensive income for the period Paid-up Equity Share Capital	Un-audited 170.34 0.35 170.70 6.64 6.64	31-03-202 Audited 49. 0. 49. 2. 2.	ded 30-0 4 30-0 Un-a 05 53 57 57 81	D6-2023 audited 42.44 2.31 44.75 1.59 1.59	Year Ended 31-03-2024 Audited 215.93 2.66 218.59 9.69 9.69
 મોટી સ્લમ ધારાવીના પુનઃવિકાસની અદાણી જૂથ સાત વર્ષની યોજના સમયસર પૂર્શ કરવા અંગે સમયમર્યાદામાં એશિયાની સૌથી અદાણી ગ્રૂપે ખાસ યોજના બનાવી મોટી ઝૂં પડપટ્ટીનો કાયાકલ્પ છે. અદાણી ગ્રૂપના ડિરેક્ટર પ્રણવ કરવાનો વિશ્વાસ ધરાવે છે". ૪૯- અદાણીએ ધારાવીના કાયાકલ્પ વર્ષીય ઉદ્યોગપતિ પ્રણવ અદાણીએ કરવાની યોજના અંગે ખાસ માહિતી અાપી હતી. અદાણી ગ્રૂપના ચાર ઉત્તરાધિકારીઓ પૈકી એક પ્રણવ સાંજકીય પક્ષો સહિત તમામ 	No. 1 Total income 2 Total Expenses Net profit / (loss) for the period (before tax, exceptional and / or extraordinal tax), exceptional and / or extraordinal terms) Net profit / (loss) for the period before	ended 30th June,2024 (Un-audited) 3.79 10.46 re rry -6.67 re or -6.67	months ended 31st March, 2024 (Audited) 8.22 19.99	Corresponding 3 months ended in the previous year 30th June, 2023 (Un-audited) 1.15 9.95 -8.8	Year ended 30th March, 2024 (Audited) 26.10 40.92 -14.82	1 2 3 4	Total Income from operations Other Income Total Income (1+2) Profit before Exceptional Items and Tax Profit before Tax Net Profit for the period Total Comprehensive income for the period	Un-audited 170.34 0.35 170.70 6.64 6.64 6.64 -	31-03-202 Audited 49. 0. 49. 2. 2. 273.	ded 30-0 4 30-0 Un-a 05 53 57 57 81	D6-2023 audited 42.44 2.31 44.75 1.59 1.59 1.59	Year Ended 31-03-2024 Audited 215.93 2.66 218.59 9.69 9.69 9.69 280.93
 મોટી સ્લમ ધારાવીના પુનઃવિકાસની અદાણી જૂથ સાત વર્ષની યોજના સમયસર પૂર્શ કરવા અંગે સમયમર્યાદામાં એશિયાની સૌથી અદાણી ગ્રૂપે ખાસ યોજના બનાવી મોટી ઝૂં પડપટ્ટીનો કાયાકલ્પ છે. અદાણી ગ્રૂપના ડિરેક્ટર પ્રણવ અદાણીએ ધારાવીના કાયાકલ્પ અદાણીએ ધારાવીના કાયાકલ્પ વર્ષીય ઉદ્યોગપતિ પ્રણવ અદાણીએ કરવાની યોજના અંગે ખાસ માહિતી આપી હતી. અદાણી ગ્રૂપના ચાર ઉત્તરાધિકારીઓ પૈકી એક પ્રણવ આદાણી જૂથના સૌથી મુશ્કેલ રાજકીય પક્ષો સહિત તમામ પ્રોજેક્ટ્સનું પૈકી એક ધારાવી હિતધારકો સાથે વાત કરીશું. દરેક 	No. 1 Total income 2 Total Expenses Net profit / (loss) for the period (before tax, exceptional and / or extraordina; litems) Net profit / (loss) for the period before tax (after exceptional and / or extraordina; litems) Net profit / (loss) for the period and / or extraordina; litems) Net profit / (loss) for the period and / atx (after exceptional and / litems)	ended 30th June,2024 (Un-audited) 3.79 10.46 re or -6.67 re or -6.67	months ended 31st March, 2024 (Audited) 8.22 19.99 -11.78 -11.78	Corresponding 3 months ended in the previous year 30th June, 2023 (Un-audited) 1.15 9.95 -8.8 -8.8	Year ended 30th March, 2024 (Audited) 26.10 40.92 -14.82 -14.82	1 2 3 4	Total Income from operations Other Income Total Income (1+2) Profit before Exceptional Items and Tax Profit before Tax Net Profit for the period Total Comprehensive income for the period Paid-up Equity Share Capital (Face value of Rs. 10/- each per Share) Earnings Per Share (EPS) of Rs. 10/- each (Not Annualised)	Un-audited 170.34 0.35 170.70 6.64 6.64 6.64 - 2,055.50	31-03-202 Audited 49. 0. 49. 20. 273. 273. 2,055.	4 30-0 4 Un-2 48 5 53 5 57 5 57 5 50 5	D6-2023 audited 42.44 2.31 44.75 1.59 1.59 2,055.50	Year Ended 31-03-2024 Audited 215.93 2.66 218.59 9.69 9.69 9.69 280.93 2,055.50
 મોટી સ્લમ ધારાવીના પુનઃવિકાસની અદાણી જૂથ સાત વર્ષની યોજના સમયસર પૂર્ણ કરવા અંગે સમયમર્યાદામાં એશિયાની સૌથી અદાણી ગ્રૂપે ખાસ યોજના બનાવી મોટી ઝૂં પડપટ્ટીનો કાયાકલ્પ છે. અદાણી ગ્રૂપના ડિરેક્ટર પ્રણવ કરવાનો વિશ્વાસ ધરાવે છે". ૪૯- અદાણીએ ધારાવીના કાયાકલ્પ કરવાનો વિશ્વાસ ધરાવે છે". ૪૯- વર્ષીય ઉદ્યોગપતિ પ્રણવ અદાણીએ કરવાની યોજના અંગે ખાસ માહિતી આપી હતી. અદાણી ગ્રૂપના ચાર ઉત્તરાધિકારીઓ પૈકી એક પ્રણવ સાથેબી સહિત લગામ પ્રોજેક્ટ્સનું પૈકી એક ધારાવી હિતધારકો સાથે વાત કરીશું. દરેક રિડેવલપમેન્ટનું સંચાલન કરી રહ્યા 	No. 1 Total income 2 Total Expenses Net profit / (loss) for the period (befor tax, exceptional and / or extraordina items) Net profit / (loss) for the period befor at (after exceptional and / extraordinanci items) Net profit / (loss) for the period aft tax (after exceptional and / extraordinanci items)	ended 30th June,2024 (Un-audited) 10.46 re re re re re re re re re re	months ended 31st March, 2024 (Audited) 8.22 19.99 -11.78 -11.78	Corresponding 3 months ended in the previous year 30th June, 2023 (Un-audited) 1.15 9.95 -8.8 -8.8	Year ended 30th March, 2024 (Audited) 26.10 40.92 -14.82	1 2 3 4	Total Income from operations Other Income Total Income (1+2) Profit before Exceptional Items and Tax Profit before Tax Net Profit for the period Total Comprehensive income for the period Paid-up Equity Share Capital (Face value of Rs. 10/- each per Share) Earnings Per Share (EPS) of Rs. 10/- each (Not Annualised) 1. Basic (Rs.)	Un-audited 170.34 0.35 170.70 6.64 6.64 6.64 - 2,055.50 0.03	31-03-202 Audited 49. 0. 49. 20. 273. 273. 2,055.	4 30-0 4 30-0 9 Un-2 53 57 57 57 50 50 33 33	D6-2023 audited 42.44 2.31 44.75 1.59 1.59 2,055.50 0.01	Year Ended 31-03-2024 Audited 215.93 2.66 218.59 9.69 9.69 9.69 280.93 2,055.50 1.37
 મોટી સ્લમ ધારાવીના પુનઃવિકાસની અદાણી જૂથ સાત વર્ષની યોજના સમયસર પૂર્ણ કરવા અંગે સમયમર્યાદામાં એશિયાની સૌથી સાંદાણી ગ્રૂપે ખાસ યોજના બનાવી મોટી ઝૂં પડપટ્ટીનો કાયાકલ્પ છે. અદાણી ગ્રૂપના ડિરેક્ટર પ્રણવ કરવાનો વિશ્વાસ ધરાવે છે". ૪૯- અદાણીએ ધારાવીના કાયાકલ્પ કરવાનો વિશ્વાસ ધરાવે છે". ૪૯- વર્ષીય ઉદ્યોગપતિ પ્રણવ અદાણીએ કરવાની યોજના અંગે ખાસ માહિતી આપી હતી. અદાણી ગ્રૂપના ચાર ઉત્તરાધિકારીઓ પૈકી એક પ્રણવ સાથેની વિશેષ વાતચીત ઇનસાઇડ અદાણીમાં જણાવ્યું હતું કે ઉત્તરાધિકારીઓ પૈકી એક પ્રણવ સાથે ગત કરીશું. દરેક વર્ષીય પક્ષો સહિત તમામ પ્રોજેક્ટ્સનું પૈકી એક ધારાવી દિતધારકો સાથે વાત કરીશું. દરેક વર્ચક્ત પોતાની રીતે અલગ-અલગ છે. ગૌતમ અદાણીની મુંબઈની 	No. 1 Total income 2 Total Expenses Net profit / (loss) for the period (before tax, exceptional and / or extraordina; litems) Net profit / (loss) for the period before tax (after exceptional and / or extraordina; litems) Net profit / (loss) for the period and / or extraordina; litems) Net profit / (loss) for the period and / atx (after exceptional and / litems)	ended 30th June,2024 (Un-audited) 3.79 10.46 re or -6.67 re or -6.67 he	months ended 31st March, 2024 (Audited) 8.22 19.99 -11.78 -11.78 -11.78	Corresponding 3 months ended in the previous year 30th June, 2023 (Un-audited) 1.15 9.95 -8.8 -8.8	Year ended 30th March, 2024 (Audited) 26.10 40.92 -14.82 -14.82 -14.82	1 2 3 4 5 6 7 8 9	Total Income from operations Other Income Total Income (1+2) Profit before Exceptional Items and Tax Profit before Tax Net Profit for the period Total Comprehensive income for the period Paid-up Equity Share Capital (Face value of Rs. 10/- each per Share) Earnings Par Share (EPS) of Rs. 10/- each (Not Annualised) 1. Basic (Rs.) 2. Diluted (Rs.)	Un-audited 170.34 0.35 170.70 6.64 6.64 6.64 - 2,055.50	31-03-202 Audited 49. 0. 49. 20. 273. 273. 2,055.	4 30-0 4 Un-2 48 5 53 5 57 5 57 5 50 5	D6-2023 audited 42.44 2.31 44.75 1.59 1.59 2,055.50	Year Ended 31-03-2024 Audited 215.93 2.66 218.59 9.69 9.69 9.69 280.93 2,055.50
 મોટી સ્લમ ધારાવીના પુનઃવિકાસની અદાણી જૂથ સાત વર્ષની યોજના સમયસર પૂર્ણ કરવા અંગે સમયમર્યાદામાં એશિયાની સૌથી અદાણી ગ્રૂપે ખાસ યોજના બનાવી મોટી ઝૂં પડપટ્ટીનો કાયાકલ્પ છે. અદાણી ગ્રૂપના ડિરેક્ટર પ્રણવ કરવાનો વિશ્વાસ ધરાવે છે". ૪૯- અદાણીએ ધારાવીના કાયાકલ્પ કરવાનો વિશ્વાસ ધરાવે છે". ૪૯- વર્ષીય ઉદ્યોગપતિ પ્રણવ અદાણીએ કરવાની યોજના અંગે ખાસ માહિતી આપી હતી. અદાણી ગ્રૂપના ચાર ઉત્તરાધિકારીઓ પૈકી એક પ્રણવ સાથેની વિશેષ વાતચીત ઇનસાઇડ અદાણીમાં જણાવ્યું હતું કે ઉત્તરાધિકારીઓ પૈકી એક પ્રણવ રાજકીય પક્ષો સહિત તમામ પ્રોજેક્ટ્સનું પૈકી એક ધારાવી હિતધારકો સાથે વાત કરીશું. દરેક રિડેવલપમેન્ટનું સંચાલન કરી રહ્યા 	No. 1 Total income 2 Total Expenses Net profit / (loss) for the period (before tax, exceptional and / or extraordina: 2 items) Net profit / (loss) for the period before tax (after exceptional and / or extraordina; 2 items) Net profit / (loss) for the period after exceptional and / extraordina; 2 items) Net profit / (loss) for the period after exceptional and / extraordina; items) Total comprehensive income for tax (after exceptional and / extraordina; items) Total comprehensive income for tax period for the period (after tax)	ended 30th June,2024 (Un-audited) 3.79 10.46 re or -6.67 re or -6.67 re -6.67 re -6.67	months ended 31st March, 2024 (Audited) 8.22 19.99 -11.78 -11.78 -11.78 -11.78	Corresponding 3 months ended in the previous year 30th June, 2023 (Un-audited) 1.15 9.95 -8.8 -8.8 -8.8 -8.8	Year ended 30th March, 2024 (Audited) 26.10 40.92 -14.82 -14.82 -14.82 -14.82	1 2 3 4 5 6 7 8 9	Total Income from operations Other Income Total Income (1+2) Profit before Exceptional Items and Tax Profit before Tax Net Profit for the period Total Comprehensive income for the period Paid-up Equity Share Capital (Face value of Rs. 10/- each per Share) Earnings Per Share (EPS) of Rs. 10/- each (Not Annualised) 1. Basic (Rs.) 2. Diluted (Rs.) tes:	Un-audited 170.34 0.35 170.70 6.64 6.64 6.64 - 2,055.50 0.03 0.03	31-03-202 Audited 49. 0. 49. 2. 2. 273. 2,055. 1. 1.	4 30-0 4 30-0 48 0 53 5 57 5 57 5 50 33 33 33	D6-2023 audited 42.44 2.31 44.75 1.59 1.59 2,055.50 0.01 0.01	Year Ended 31-03-2024 Audited 215.93 2.66 218.59 9.69 9.69 280.93 2,055.50 1.37 1.37
 મોટી સ્લમ ધારાવીના પુનઃવિકાસની અદાણી જૂથ સાત વર્ષની યોજના સમયસર પૂર્ણ કરવા અંગે સમયમર્યાદામાં એશિયાની સૌથી સગદાણી ગ્રૂપે ખાસ યોજના બનાવી મોટી ઝૂં પડપટ્ટીનો કાયાકલ્પ કરવાનો વિશ્વાસ ધરાવે છે". ૪૯- અદાણીએ ધારાવીના કાયાકલ્પ કરવાનો વિશ્વાસ ધરાવે છે". ૪૯- અદાણીએ ધારાવીના કાયાકલ્પ કરવાનો વિશ્વાસ ધરાવે છે". ૪૯- વર્ષીય ઉદ્યોગપતિ પ્રણવ અદાણીએ કરવાની યોજના અંગે ખાસ માહિતી આપી હતી. અદાણી ગ્રૂપના ચાર ઉત્તરાધિકારીઓ પૈકી એક પ્રણવ આદાણીમાં જણાવ્યું હતું કે "અમે પ્રોજેક્ટનો વિરોધ કરનાર અદાણી જૂથના સૌથી મુશ્કેલ રાજકીય પક્ષો સહિત તમામ પ્રોજેક્ટ્સનું પૈકી એક ધારાવી દિતધારકો સાથે વાત કરીશું. દરેક રાજકીય પક્ષો સહિત તમામ છે. ગૌતમ અદાણીની મુંબઈની લચારતા હોય છે. આમારા ગ્રુપને દર્૨૦ એકર (૨૫૧ હેક્ટર) પ્રાઇમ 	No. 1 Total income 2 Total Expensives Net profit / (loss) for the period (before tax, exceptional and / or extraordina: 2 items) Net profit / (loss) for the period before tax (after exceptional and / or extraordinate items) Net profit / (loss) for the period and / or extraordinate items) Net profit / (loss) for the period and / extraordinary items) Total comprehensive income for the seriod (after tax) 6 Paid up equity share capital	ended 30th June,2024 (Un-audited) 	months ended 31st March, 2024 (Audited) 8.22 19.99 -11.78 -11.78 -11.78	Corresponding 3 months ended in the previous year 30th June, 2023 (Un-audited) 1.15 9.95 -8.8 -8.8	Year ended 30th March, 2024 (Audited) 26.10 40.92 -14.82 -14.82 -14.82 -14.82 308.94	1 2 3 4 5 6 7 8 8 9	Total Income from operations Other Income Total Income (1+2) Profit before Exceptional Items and Tax Profit before Tax Net Profit for the period Total Comprehensive income for the period Paid-up Equity Share Capital (Face value of Rs. 10/- each per Share) Earnings Par Share (EPS) of Rs. 10/- each (Not Annualised) 1. Basic (Rs.) 2. Diluted (Rs.) tes: The above Un-audited Standalone financial reviewed by the Audit Committee and approv	Un-audited 170.34 0.35 170.70 6.64 6.64 6.64 - 2,055.50 0.03 0.03 results for th ved by the Boa	31-03-202 Audited 49. 0. 49. 2. 2. 2. 2. 2. 2. 55. 1. 1. 1. 1. 0. 2. 055. 0. 1. 1. 0. 0. 2. 0. 0. 0. 0. 0. 0. 0. 0. 0. 0. 0. 0. 0.	ded 30-0 4 30-0 48 0-5 53 57 57 57 81	J6-2023 audited 42.44 2.31 44.75 1.59 1.59 2,055.50 0.01 0.01 0.01 0.01 0.01	Year Ended 31-03-2024 Audited 215.93 2.66 218.59 9.69 9.69 280.93 2,055.50 1.37 1.37 1.37 24 have been meetings held
 મોટી સ્લમ ધારાવીના પુનઃવિકાસની યોજના સમયસર પૂર્જા કરવા અંગે અદાણી ગ્રૂપે ખાસ યોજના બનાવી છે. અદાણી ગ્રૂપના ડિરેક્ટર પ્રણવ અદાણીએ ધારાવીના કાયાકલ્પ કરવાની યોજના અંગે ખાસ માહિતી આપી હતી. અદાણી ગ્રૂપના ચાર ઉત્તરાધિકારીઓ પૈકી એક પ્રણવ અદાણી જૂથના સૌથી મુશ્કેલ પ્રોજેક્ટ્સનું પૈકી એક ધારાવી રિડેવલપમેન્ટનું સંચાલન કરી રહ્યા છે. ગૌતમ અદાણીની મુંબઈની ૬૨૦ એકર (૨૫૧ હેક્ટર) પ્રાઇમ ખેદાણી જૂથી સાત વર્ષની સંચાર્ય છે કે સાત વર્ષમાં આ પ્રોજેક્ટ વ્યક્તિ પોતાની રીતે અલગ-અલગ વિચારતા હોય છે. આમારા ગ્રુપને વિચારતા હોય છે. આમારા ગ્રુપને વચાસ છે કે સાત વર્ષમાં આ પ્રોજેક્ટ 	No. 1 Total income 2 Total Expenses Net profit / (loss) for the period (before tax, exceptional and / or extraordina: 2 items) Net profit / (loss) for the period before tax (after exceptional and / or extraordina: 2 items) Net profit / (loss) for the period after exceptional and / extraordinary items) Total comprehensive income for tax (after exceptional and / extraordinary items) Total comprehensive income for tax (after exceptional and / extraordinary items) Total comprehensive income for tax (after exceptional and / extraordinary items) Total comprehensive income for tax (after exceptional and / extraordinary items) Total comprehensive income for tax (after exceptional and / extraordinary items) Total comprehensive income for tax (after exceptional and / a extraordinary items) Total comprehensive income for tax (after exceptional and / a extraordinary items) Total comprehensive income for tax (after exceptional and / a extraordinary items) Reserve (excluding revaluation reserve)	ended 30th June,2024 (Un-audited) 10.46 re re or -6.67 re -6.77 re -7.77 re -7.77 re -7.77 re -7.77 re -7.77 re -7.77 re	months ended 31st March, 2024 (Audited) 8.22 19.99 -11.78 -11.78 -11.78 -11.78	Corresponding 3 months ended in the previous year 30th June, 2023 (Un-audited) 1.15 9.95 -8.8 -8.8 -8.8 -8.8	Year ended 30th March, 2024 (Audited) 26.10 40.92 -14.82 -14.82 -14.82 -14.82	1 2 3 4 5 6 7 8 8 9	Total Income from operations Other Income Total Income (1+2) Profit before Exceptional Items and Tax Profit before Tax Net Profit for the period Total Comprehensive income for the period Paid-up Equity Share Capital (Face value of Rs. 10/- each per Share) Earnings Per Share (EPS) of Rs. 10/- each (Not Annualised) 1. Basic (Rs.) 2. Diluted (Rs.) tes: The above Un-audited Standalone financial reviewed by the Audit Committee and approv on 12th August, 2024 and the Limited Revie	Un-audited 170.34 0.35 170.70 6.64 6.64 6.64 - 2,055.50 0.03 0.03 results for th ved by the Boa	31-03-202 Audited 49. 0. 49. 2. 2. 2. 2. 2. 2. 55. 1. 1. 1. 1. 0. 2. 055. 0. 1. 1. 0. 0. 2. 0. 0. 0. 0. 0. 0. 0. 0. 0. 0. 0. 0. 0.	ded 30-0 4 30-0 48 0-5 53 57 57 57 81	J6-2023 audited 42.44 2.31 44.75 1.59 1.59 2,055.50 0.01 0.01 0.01 0.01 0.01	Year Ended 31-03-2024 Audited 215.93 2.66 218.59 9.69 9.69 280.93 2,055.50 1.37 1.37 1.37 24 have been meetings held
 મોટી સ્લમ ધારાવીના પુનઃવિકાસની યોજના સમયસર પૂર્ણ કરવા અંગે અદાણી ગ્રૂપે ખાસ યોજના બનાવી છે. અદાણી ગ્રૂપના ડિરેક્ટર પ્રણવ અદાણીએ ધારાવીના કાયાકલ્પ કરવાની યોજના અંગે ખાસ માહિતી આપી હતી. અદાણી ગ્રૂપના ચાર ઉત્તરાધિકારીઓ પૈકી એક પ્રણવ અદાણી જૂથના સૌથી મુશ્કેલ પ્રોજેક્ટ્સનું પૈકી એક ધારાવી રિડેવલપમેન્ટનું સંચાલન કરી રહ્યા છે. ગૌતમ અદાણીની મુંબઈની ૬૨૦ એકર (૨૫૧ હેક્ટર) પ્રાઇમ લેન્ડને એક શાઈનીંગ સીટી હબ બનાવવાની ઇં૩ બિલિયનની અદાણી જૂથ સાત વર્ષની સમયમર્યાદામાં એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીનો કાયાકલ્પ કરવાનો વિશ્વાસ ધરાવે છે". ૪૯- વર્ષીય ઉદ્યોગપતિ પ્રણવ અદાણીએ બલૂમબર્ગ સાથેની વિશેષ વાતચીત ઇનસાઇડ અદાણીમાં જણાવ્યું હતું કે "અમે પ્રોજેક્ટનો વિરોધ કરનાર રાજકીય પક્ષો સહિત તમામ હિતધારકો સાથે વાત કરીશું. દરેક વ્યક્તિ પોતાની રીતે અલગ-અલગ વિચારતા હોય છે. અમારા ગ્રુપને વિશ્વાસ છે કે સાત વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે, કારણ કે જેઓ ત્યાંની અમાનવીય પરિસ્થિતિઓમાં જીવી 	No. 1 Total income 2 Total Expensives Net profit / (loss) for the period (before tax, exceptional and / or extraordina: 2 items) Net profit / (loss) for the period before tax (after exceptional and / or extraordinate items) Net profit / (loss) for the period and / or extraordinate items) Net profit / (loss) for the period and / extraordinary items) Total comprehensive income for the seriod (after tax) 6 Paid up equity share capital	ended 30th June,2024 (Un-audited) 10.46 re re or -6.67 re -6.67 re -6.67 end -6.67 -6.67 end -6.77 end -7.77 end -7.77 end -7.77 end -7.77 end -7.77 end -7.77 end -7.77 end -7.77 end -7.77 end -7.77 end -7.77 end -7.7	months ended 31st March, 2024 (Audited) 8.22 19.99 -11.78 -11.78 -11.78 -11.78 308.94 0	Corresponding 3 months ended in the previous year 30th June, 2023 (Un-audited) 1.15 9.95 -8.8 -8.8 -8.8 -8.8 -8.8 308.94 0	Year ended 30th March, 2024 (Audited) 26.10 40.92 -14.82 -14.82 -14.82 -14.82 308.94 229.58	1 2 3 4 5 6 7 8 8 9	Total Income from operations Other Income Total Income (1+2) Profit before Exceptional Items and Tax Profit before Tax Net Profit for the period Total Comprehensive income for the period Paid-up Equity Share Capital (Face value of Rs. 10/- each per Share) Earnings Per Share (EPS) of Rs. 10/- each (Not Annualised) 1. Basic (Rs.) 2. Diluted (Rs.) tes: The above Un-audited Standalone financial reviewed by the Audit Committee and approv on 12th August, 2024 and the Limited Revie of the Company.	Un-audited 170.34 0.35 170.70 6.64 6.64 - 2,055.50 0.03 0.03 volume 0.03 0.03 wof the Boarw	31-03-202 Audited 49. 0. 49. 2. 273. 2,055. 1. 1. 1. 1. e Quarter e rd of Director has been ca	4 30-0 4 30-0 9 Un-2 53 57 57 57 57 57 50 33 33 33 ended 30t arried out	J6-2023 audited 42.44 2.31 44.75 1.59 1.59 2,055.50 0.01 0.01 0.01 0.01 0.01 0.01 0.01	Year Ended 31-03-2024 Audited 215.93 2.66 218.59 9.69 9.69 280.93 2,055.50 1.37 1.37 1.37 24 have been meetings held cutory Auditors
 મોટી સ્લમ ધારાવીના પુનઃવિકાસની યોજના સમયસર પૂર્ણ કરવા અંગે અદાણી ગ્રૂપે ખાસ યોજના બનાવી છે. અદાણી ગ્રૂપના ડિરેક્ટર પ્રણવ અદાણીએ ધારાવીના કાયાકલ્પ કરવાની યોજના અંગે ખાસ માહિતી આપી હતી. અદાણી ગ્રૂપના ચાર ઉત્તરાધિકારીઓ પૈકી એક પ્રણવ અદાણી જૂથના સૌથી મુશ્કેલ પ્રોજેક્ટ્સનું પૈકી એક ધારાવી દરેવલપમેન્ટનું સંચાલન કરી રહ્યા છે. ગૌતમ અદાણીની મુંબઈની દર૦ એકર (રપ૧ હેક્ટર) પ્રાઇમ લેન્ડને એક શાઈનીંગ સીટી હબ બનાવવાની ઇં૩ બિલિયનની યોજના હાલ ચર્ચાના ચગડોળે છે. અદાણી જૂથ સાત વર્ષની સમયમર્યાદામાં એશિયાની સૌથી સમયમર્યાદામાં એશિયાની સૌથી મોટી ગ્રૂપપષ્ટી ગે કારાશન હત્રાધકારીઓ પૈકી એક પ્રણવ રાજકીય પક્ષો સહિત તમામ હિતધારકો સાથે વાત કરીશું. દરેક વ્યક્તિ પોતાની રીતે અલગ-અલગ વિચારતા હોય છે. અમારા ગ્રુપને વિચારતા હોય છે. આગરા ગ્રુપને વિચારતા છે તેઓ અમને સંપૂર્ણ સમર્થન 	No. 1 Total income 2 Total Expenses Net profit / (loss) for the period (before tax, exceptional and / or extraordinazitems) Net profit / (loss) for the period before tax (after exceptional and / or extraordinazitems) Net profit / (loss) for the period after exceptional and / extraordinazitems) Net profit / (loss) for the period after exceptional and / extraordinazitems) Total comprehensive income for tax (after exceptional and / extraordinazitems) Total comprehensive income for tax period for the period (after tax) 6 Paid up equity share capital 7 Reserve (excluding revaluation reserve Earning per share (of Rs. 10/-eade 8 Basic and Diluted	ended 30th June,2024 (Un-audited) 10.46 re re or -6.67 re -6.77 re -7.77 re -7.77 re -7.77 re -7.77 re -7.77 re -7.77 re	months ended 31st March, 2024 (Audited) 8.22 19.99 -11.78 -11.78 -11.78 -11.78 308.94 0	Corresponding 3 months ended in the previous year 30th June, 2023 (Un-audited) 1.15 9.95 -8.8 -8.8 -8.8 -8.8	Year ended 30th March, 2024 (Audited) 26.10 40.92 -14.82 -14.82 -14.82 -14.82 308.94 229.58	1 2 3 4 5 6 7 8 8 9	Total Income from operations Other Income Total Income (1+2) Profit before Exceptional Items and Tax Profit before Tax Net Profit for the period Total Comprehensive income for the period Paid-up Equity Share Capital (Face value of Rs. 10/- each per Share) Earnings Per Share (EPS) of Rs. 10/- each (Not Annualised) 1. Basic (Rs.) 2. Diluted (Rs.) tes: The above Un-audited Standalone financial reviewed by the Audit Committee and approv on 12th August, 2024 and the Limited Revie of the Company. The above is an extract of the detailed form ended on 30th June, 2024 filed with the Sto	Un-audited 170.34 0.35 170.70 6.64 6.64 6.64 - 2,055.50 0.03 0.03 0.03 0.03 void by the Boar w of the same at of Standalor ck Exchange u	31-03-202 Audited 49. 0. 49. 2. 273. 2,055. 1. 1. 1. e Quarter et rd of Directo has been ca ne Un-audite nder Regula	ded 30-0 4 30-0 48 0-5 53 57 57 57 81	J6-2023 audited 42.44 2.31 44.75 1.59 1.59 2,055.50 0.01 0.01 0.01 0.01 1.59 2,055.50	Year Ended 31-03-2024 Audited 215.93 2.66 218.59 9.69 9.69 280.93 2,055.50 1.37 1.37 1.37 24 have been meetings held cutory Auditors or the Quarter ng Oblications
 મોટી સ્લમ ધારાવીના પુનઃવિકાસની યોજના સમયસર પૂર્ણ કરવા અંગે અદાણી ગ્રૂપે ખાસ યોજના બનાવી છે. અદાણી ગ્રૂપના ડિરેક્ટર પ્રણવ અદાણીએ ધારાવીના કાયાકલ્પ કરવાની યોજના અંગે ખાસ માહિતી આપી હતી. અદાણી ગ્રૂપના ચાર ઉત્તરાધિકારીઓ પૈકી એક પ્રણવ અદાણી જૂથના સૌથી મુશ્કેલ પ્રોજેક્ટ્સનું પૈકી એક ધારાવી રિડેવલપમેન્ટનું સંચાલન કરી રહ્યા છે. ગૌતમ અદાણીની મુંબઈની ૬૨૦ એકર (૨૫૧ હેક્ટર) પ્રાઇમ લેન્ડને એક શાઈનીંગ સીટી હબ બનાવવાની ઇં૩ બિલિયનની અદાણી જૂથ સાત વર્ષની સમયમર્યાદામાં એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીનો કાયાકલ્પ કરવાનો વિશ્વાસ ધરાવે છે". ૪૯- વર્ષીય ઉદ્યોગપતિ પ્રણવ અદાણીએ બલૂમબર્ગ સાથેની વિશેષ વાતચીત ઇનસાઇડ અદાણીમાં જણાવ્યું હતું કે "અમે પ્રોજેક્ટનો વિરોધ કરનાર રાજકીય પક્ષો સહિત તમામ હિતધારકો સાથે વાત કરીશું. દરેક વ્યક્તિ પોતાની રીતે અલગ-અલગ વિચારતા હોય છે. અમારા ગ્રુપને વિશ્વાસ છે કે સાત વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે, કારણ કે જેઓ ત્યાંની અમાનવીય પરિસ્થિતિઓમાં જીવી 	No. 1 Total income 2 Total Expenses Net profit / (loss) for the period (before tax, exceptional and / or extraordinazitems) Net profit / (loss) for the period before tax (after exceptional and / or extraordinazitems) Net profit / (loss) for the period after exceptional and / extraordinazy items) Total comprehensive income for tax (after exceptional and / extraordinazy items) Total comprehensive income for tax (after exceptional and / extraordinazy items) Total comprehensive income for tax (after exceptional and / a extraordinazy items) Total comprehensive income for tax (after exceptional and / a extraordinazy items) Total comprehensive income for tax (after exceptional and / a extraordinazy items) Total comprehensive income for tax (after exceptional and / a extraordinazy items) Total comprehensive income for tax (after exceptional and / a extraordinazy items) Total comprehensive income for tax (after exceptional and / a extraordinazy items) Faid up equity share capital Z Reserve (excluding revaluation reserve (a gasa and Diluted Note: (1)The above is an extract of the detailed for	ended 30th June,2024 (Un-audited) 3.79 10.46 re or -6.67 re or -6.67 re or -6.67 re -6.7 re -7 re -7 re -7 re -7 re -7 re -7 re -7 re -7 re -7 re -7 re -7 re -7 re -7 re -7 re -7 re -7 re -7 re -7 -7 re -7 re -7 re -7 re -	months ended 31st March, 2024 (Audited) 8.22 19.99 -11.78 -11.78 -11.78 -11.78 -11.78 0 -11.78 -11	Corresponding 3 months ended in the previous year 30th June, 2023 (Un-audited) 1.15 9.95 -8.8 -8.8 -8.8 -8.8 308.94 0 -0.28 he quarter ended 30th	Year ended 30th March, 2024 (Audited) 26.10 40.92 -14.82 -14.82 -14.82 -14.82 308.94 229.58 -0.48 June, 2024 field with	1 2 3 4 5 6 7 8 8 9	Total Income from operations Other Income Total Income (1+2) Profit before Exceptional Items and Tax Profit before Tax Net Profit for the period Total Comprehensive income for the period Paid-up Equity Share Capital (Face value of Rs. 10/- each per Share) Earnings Par Share (EPS) of Rs. 10/- each (Not Annualised) 1. Basic (Rs.) 2. Diluted (Rs.) tes: The above Un-audited Standalone financial reviewed by the Audit Committee and approv on 12th August, 2024 and the Limited Revie of the Company. The above is an extract of the detailed form ended on 30th June, 2024 filed with the Sto & Disclosure Requirements) Regulations, 20	Un-audited 170.34 0.35 170.70 6.64 6.64 6.64 - 2,055.50 0.03 0.03 0.03 0.03 0.03 0.03 0.03 0.03 0.03 0.03 0.03 0.03 0.03 0.03 0.03 0.04 0.05	31-03-202 Audited 49. 0. 49. 2. 2. 2. 2. 2. 2. 2. 2. 5. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1.	ded 30-0 4 30-0 48 05 53 57 57 57 81 05 33 33 33 33 arried out 30 their sin their sin their sin their sin their sin their son 33 of e Un-aud	J6-2023 audited 42.44 2.31 44.75 1.59 1.59 2,055.50 0.01 0.01 0.01 0.01 1.59 2.055.50	Year Ended 31-03-2024 Audited 215.93 2.66 218.59 9.69 9.69 280.93 2,055.50 1.37 1.37 1.37 24 have been meetings held cutory Auditors for the Quarter ng Obligations alone Financial
 મોટી સ્લમ ધારાવીના પુનઃવિકાસની યોજના સમયસર પૂર્શ કરવા અંગે અદાશી ગ્રૂપે ખાસ યોજના બનાવી છે. અદાશી ગ્રૂપના ડિરેક્ટર પ્રશવ અદાશી ગ્રેપના ડેરેક્ટર પ્રશવ અદાશી ગ્રેપના સૌથી મુશ્કેલ અદાશી વ્યાર છેકેટનો વિરોધ કરનાર રાજકીય પક્ષો સહિત તમામ હિતધારકો સાથે વાત કરીશું. દરેક અદાય બેતે અલગ-અલગ વિચારતા હોય છે. અમારા ગ્રુપને વિચાસ છે કે સાત વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે, કારણ કે જેઓ ત્યાંની અમાનવીય પરિસ્થિતિઓમાં જીવી રહ્યા છે તેઓ અમને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે." (૧૯-૧૧) 	No. 1 Total income 2 Total Expenses Net profit / (loss) for the period (before tax, exceptional and / or extraordina: 2 items) Net profit / (loss) for the period before tax (after exceptional and / or extraordination time) Net profit / (loss) for the period and / or extraordination time) Net profit / (loss) for the period and / extraordinary items) Total comprehensive income for the period for the period (after tax) 6 Paid up equity share capital 7 Reserve (excluding revaluation reserve Earning per share (of Rs. 10/-ead Basic and Diluted Note: (1)The above is an extract of the detailed for Stock Exchange under regulation 33 of the Stock exchange under regulation stockex exchange under regulation stock exchange under regu	ended 30th June,2024 (Un-audited) 3.79 10.46 re re or -6.67 re or -6.67 er or -6.67 -6.67 0 -6.67 0 -6.67 -6.67 0 -6.67 -6.7 -6.7 -6.7 -6.7 -6.7 -6.7 -6.7 -6.7 -6.7 -6.7 -6.7 -6.7 -6.7 -6.7 -6.7 -6.7 -6.7 -6.7 -7.22 -7	months ended 31st March, 2024 (Audited) 8.22 19.99 -11.78 -11.78 -11.78 -11.78 308.94 0 -0.38 Financial Results for t tions & Disclosure Re	Corresponding 3 months ended in the previous year 30th June, 2023 (Un-audited) 1.15 9.95 -8.8 -8.8 -8.8 -8.8 -8.8 308.94 0 -0.28 he quarter ended 30th quirements) Regulation	Year ended 30th March, 2024 (Audited) 26.10 40.92 -14.82 -14.82 -14.82 -14.82 308.94 229.58 -0.48 June, 2024 field with s, 2015.	1 2 3 4 5 6 7 8 8 9	Total Income from operations Other Income Total Income (1+2) Profit before Exceptional Items and Tax Profit before Tax Net Profit for the period Total Comprehensive income for the period Paid-up Equity Share Capital (Face value of Rs. 10/- each per Share) Earnings Per Share (EPS) of Rs. 10/- each (Not Annualised) 1. Basic (Rs.) 2. Diluted (Rs.) tes: The above Un-audited Standalone financial reviewed by the Audit Committee and approv on 12th August, 2024 and the Limited Revie of the Company. The above is an extract of the detailed form ended on 30th June, 2024 filed with the Sto & Disclosure Requirements) Regulations, 2(Results for the Quarter ended on 30th J	Un-audited 170.34 0.35 170.70 6.64 6.64 6.64 - 2,055.50 0.03 0.03 0.03 0.03 0.03 0.03 0.15 the Boar at of Standalou ck Exchange u 015. The full f une, 2024 are	31-03-202 Audited 49. 0. 49. 2. 2. 2. 2. 2. 2. 2. 2. 55. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1.	ded 4 30-0 48 05 53 57 57 81 57 81 50 33 33 33 anded 30t arried out ed Financi tion 33 of e Un-aud on the S	J6-2023 audited 42.44 2.31 44.75 1.59 1.59 2,055.50 0.01 0.01 0.01 0.01 1.59 2.055.50	Year Ended 31-03-2024 Audited 215.93 2.66 218.59 9.69 9.69 280.93 2,055.50 1.37 1.37 1.37 24 have been meetings held cutory Auditors for the Quarter ng Obligations alone Financial
 મોટી સ્લમ ધારાવીના પુનઃવિકાસની યોજના સમયસર પૂર્શ કરવા અંગે અદાશી ગ્રૂપે ખાસ યોજના બનાવી છે. અદાશી ગ્રૂપના ડિરેક્ટર પ્રશવ અદાશી બ્રૂપના ડિરેક્ટર પ્રશવ અદાશી બ્રૂપના ડિરેક્ટર પ્રશવ અદાશી બ્રુપના ડેરેક્ટર પ્રશવ અદાશી બ્રુપના ચાર અદાશી બ્રૂપના ચાર અદાશી બ્રૂપના ચાર અદાશી બ્રૂપના ચાર અદાશી બ્રૂપના ચાર અદાશી બ્રૂપના સૌથી મુશ્કેલ અદાશી બ્રુથના સૌથી મુશ્કેલ અદાશી બ્રુથના સૌથી મુશ્કેલ અદાશી બ્રુથના સૌથી મુશ્કેલ અદાશી વિશેષ વાતચીત અદાશી બ્રુથના સૌથી મુશ્કેલ અદાશી બ્રુથના સૌથી મુશ્કેલ અદાશી વિશેષ વાતચીત અદાશી ગ્રેક્ટરનો વિરોધ કરનાર રાજકીય પક્ષો સહિત તમામ હિતધારકો સાથે વાત કરીશું. દરેક અદાયે પે બે અનને સંપુર્શ સમર્થન આપી રહ્યા છે તેઓ અમને સંપૂર્શ સમર્થન આપી રહ્યા છે." (૧૯-૧૧) 	No. 1 Total income 2 Total Expenses Net profit / (loss) for the period (before tax, exceptional and / or extraordina: 2 items) Net profit / (loss) for the period before tax (after exceptional and / extraordinary items) Net profit / (loss) for the period after exceptional and / extraordinary items) Total comprehensive income for the period for the period (after tax) 6 Paid up equity share capital 7 Reserve (excluding revaluation reserve gasaic and Diluted Note: (1)The above is an extract of the detailed for Stock Exchange under regulation 33 of the Start (2)The full format of the same alongwith the	ended 30th June,2024 (Un-audited) 3.79 10.46 re or -6.67 re or -6.67 re -6.67 en -6.7 en -6.67 en -6.67 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -7.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -7.7 en	months ended 31st March, 2024 (Audited) 8.22 19.99 -11.78 -11.78 -11.78 -11.78 308.94 0 -0.38 Financial Results for t tions & Disclosure Re	Corresponding 3 months ended in the previous year 30th June, 2023 (Un-audited) 1.15 9.95 -8.8 -8.8 -8.8 -8.8 308.94 0 -0.28 he quarter ended 30th quirements) Regulation c exchange at www.bs	Year ended 30th March, 2024 (Audited) 26.10 40.92 -14.82 -14.82 -14.82 -14.82 308.94 229.58 -0.48 June, 2024 field with hs, 2015. eindia.com and at the	1 2 3 4 5 6 7 8 8 9	Total Income from operations Other Income Total Income (1+2) Profit before Exceptional Items and Tax Profit before Tax Net Profit for the period Total Comprehensive income for the period Paid-up Equity Share Capital (Face value of Rs. 10/- each per Share) Earnings Par Share (EPS) of Rs. 10/- each (Not Annualised) 1. Basic (Rs.) 2. Diluted (Rs.) tes: The above Un-audited Standalone financial reviewed by the Audit Committee and approv on 12th August, 2024 and the Limited Revie of the Company. The above is an extract of the detailed form ended on 30th June, 2024 filed with the Sto & Disclosure Requirements) Regulations, 20	Un-audited 170.34 0.35 170.70 6.64 6.64 6.64 - 2,055.50 0.03 0.03 0.03 0.03 0.03 0.03 0.15 the Boar at of Standalou ck Exchange u 015. The full f une, 2024 are	31-03-202 Audited 49. 0. 49. 2. 2. 2. 2. 2. 2. 2. 2. 55. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1.	ded 4 30-0 48 05 53 57 57 81 50 33 33 33 ended 30t ors in their arried out ed Financi tion 33 of e Un-aud on the S om.	J6-2023 audited 42.44 2.31 44.75 1.59 1.59 2,055.50 0.01 0.01 0.01 0.01 1.59 2,055.50 1.59 1.59 1.59 1.59 1.59 1.59 1.59 1.59 1.59 1.59 1.59 1.59 1.59 1.59 1.59 1.59 1.59 1.59 1.59 1.50 1.51 1.51 1.51 1.51 1.51 1.51 1.51 1.51 1.51 1.51 1.52 1.51 1.51 1.51 1.51 <t< td=""><td>Year Ended 31-03-2024 Audited 215.93 2.66 218.59 9.69 9.69 280.93 2,055.50 1.37 1.37 1.37 24 have been meetings held tutory Auditors for the Quarter ng Obligations alone Financial ange website:</td></t<>	Year Ended 31-03-2024 Audited 215.93 2.66 218.59 9.69 9.69 280.93 2,055.50 1.37 1.37 1.37 24 have been meetings held tutory Auditors for the Quarter ng Obligations alone Financial ange website:
hìટl સ્લમ ધારાવીના પુનઃવિકાસની યોજના સમયસર પૂર્શ કરવા અંગે અદાશી ગ્રૂપે ખાસ યોજના બનાવી છે. અદાશી ગ્રૂપના ડેરેક્ટર પ્રશવ અદાશી ગ્રૂપના ડેરેક્ટર પ્રશવ અદાશીએ ધારાવીના કાયાકલ્પ કરવાની વેશ્વાસ ધરાવે છે". ૪૯- વર્ષીય ઉદ્યોગપતિ પ્રશવ અદાશીએ કરવાની યોજના અંગે ખાસ માહિતી આપી હતી. અદાશી ગ્રૂપના ચાર ઉત્તરાધિકારીઓ પૈકી એક પ્રશવ અદાશી જૂથના સૌથી મુશ્કેલ પોજે ક્ટ્સનું પૈકી એક ધારાવી દેડેવલપમેન્ટનું સંચાલન કરી રહ્યા છે. ગૌતમ અદાશીની મુંબઈની $ε ૨૦ એકર (૨૫૧ હેક્ટર) પ્રાઇમલેન્ડને એક શાઈનીંગ સીટી હબપાંજના હાલ ચર્ચાના ચગડોળે છે.તેવામાં પ્રશવ અદાશીએ જણાવ્યુંDrinted and Published by MAYUR C. BHATT on behalf of KALYANIPUBLIATION PVT. LTD. and Printed at : Dharti Printers C-3, Shankarઅદાશી જૂથ સાત વર્ષ નાસાંગે ગે બાત માં ગાયે જાગ્યસાં છે તેઓ માં જાગ્યસાં છે. જાતમાં Printers C-3, Shankar$	No. 1 Total income 2 Total Expenses Net profit / (loss) for the period (before tax, exceptional and / or extraordina: 2 items) Net profit / (loss) for the period before tax (after exceptional and / or extraordination time) Net profit / (loss) for the period and / or extraordination time) Net profit / (loss) for the period and / extraordinary items) Total comprehensive income for the period for the period (after tax) 6 Paid up equity share capital 7 Reserve (excluding revaluation reserve Earning per share (of Rs. 10/-ead Basic and Diluted Note: (1)The above is an extract of the detailed for Stock Exchange under regulation 33 of the Stock exchange under regulation stockex exchange under regulation stock exchange under regu	ended 30th June,2024 (Un-audited) 3.79 10.46 re or -6.67 re or -6.67 re -6.67 en -6.7 en -6.67 en -6.67 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -7.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -7.7 en	months ended 31st March, 2024 (Audited) 8.22 19.99 -11.78 -11.78 -11.78 -11.78 308.94 0 -0.38 Financial Results for t tions & Disclosure Re	Corresponding 3 months ended in the previous year 30th June, 2023 (Un-audited) 1.15 9.95 -8.8 -8.8 -8.8 -8.8 308.94 0 -0.28 he quarter ended 30th quirements) Regulation c exchange at www.bs	Year ended 30th March, 2024 (Audited) 26.10 40.92 -14.82 -14.82 -14.82 -14.82 308.94 229.58 -0.48 June, 2024 field with ns, 2015. eindia.com and at the curities Limited	1 2 3 4 5 6 7 8 8 9	Total Income from operations Other Income Total Income (1+2) Profit before Exceptional Items and Tax Profit before Tax Net Profit for the period Total Comprehensive income for the period Paid-up Equity Share Capital (Face value of Rs. 10/- each per Share) Earnings Per Share (EPS) of Rs. 10/- each (Not Annualised) 1. Basic (Rs.) 2. Diluted (Rs.) tes: The above Un-audited Standalone financial reviewed by the Audit Committee and approv on 12th August, 2024 and the Limited Revie of the Company. The above is an extract of the detailed form ended on 30th June, 2024 filed with the Sto & Disclosure Requirements) Regulations, 2(Results for the Quarter ended on 30th J	Un-audited 170.34 0.35 170.70 6.64 6.64 6.64 - 2,055.50 0.03 0.03 0.03 0.03 0.03 0.03 0.15 the Boar at of Standalou ck Exchange u 015. The full f une, 2024 are	31-03-202 Audited 49. 0. 49. 2. 2. 2. 2. 2. 2. 2. 2. 55. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1.	ded 4 30-0 48 05 53 57 57 81 50 33 33 33 ended 30t ors in their arried out ed Financi tion 33 of e Un-aud on the S om.	J6-2023 audited 42.44 2.31 44.75 1.59 1.59 2,055.50 0.01 0.01 0.01 0.01 0.01 0.01 0.01 0.55 0.01 0.02 0.03 0.04 0.05 0.05 0.06 0.07 0.08 0.	Year Ended 31-03-2024 Audited 215.93 2.66 218.59 9.69 9.69 280.93 2,055.50 1.37 1.37 1.37 24 have been meetings held cutory Auditors for the Quarter ng Obligations alone Financial ange website: alf of the Board
hìટl સ્લમ ધારાવીના પુનઃવિકાસની યોજના સમયસર પૂર્શ કરવા અંગે અદાશી ગ્રૂપે ખાસ યોજના બનાવી છે. અદાશી ગ્રૂપના ડિરેક્ટર પ્રણવ અદાશી ગ્રૂપના ડિરેક્ટર પ્રણવ અદાશીએ ધારાવીના કાયાકલ્પ કરવાની યોજના અંગે ખાસ માહિતી આપી હતી. અદાશી ગ્રૂપના ચાર ઇત્તરાધિકારીઓ પૈકી એક પ્રણવ અદાશી જૂથના સૌથી મુશ્કેલ પોજે ક્ટ્સનું પૈકી એક ધારાવી દિતધારકો સાથે વાત કરીશું. દરેક વર્ચાસ છે કે સાત વર્ષમાં આ પ્રોજેક્ટ સાં પેકી એક પ્રણવ અદાશી જૂથના સૌથી મુશ્કેલ રાજકીય પક્ષો સહિત તમામ પોજે કટ્સનું પૈકી એક ધારાવી દિતધારકો સાથે વાત કરીશું. દરેક વ્યક્તિ પોતાની રીતે અલગ-અલગ દેત્વામાં પ્રણવ અદાશીએ જણાવ્યું છે જશે, કારણ કે જેઓ ત્યાંની વિશ્વાસ છે કે સાત વર્ષમાં આ પ્રોજેક્ટ વાં વા ચારા છે. આતારા ગ્રુપને દર્નર એક શાઈનીંગ સીટી હબ યુર્ણ થઈ જશે, કારણ કે જેઓ ત્યાંની ચોજના હાલ ચર્ચાના ચગડોળે છે. તેવામાં પ્રણવ અદાણીએ જણાવ્યું Drinted and Published by MAYUR C. BHATT on behalf of KALYANI PUBLIATION PVT. LTD. and Printed at : Dharti Printers C-3, Shankar Chember, Nr. Fadia Chamber, Asharam Road, Ahmedabad-Published 	No. 1 Total income 2 Total Expenses Net profit / (loss) for the period (before tax, exceptional and / or extraordina: 2 items) Net profit / (loss) for the period before tax (after exceptional and / extraordinary items) Net profit / (loss) for the period after exceptional and / extraordinary items) Total comprehensive income for the period for the period (after tax) 6 Paid up equity share capital 7 Reserve (excluding revaluation reserve gasaic and Diluted Note: (1)The above is an extract of the detailed for Stock Exchange under regulation 33 of the Start (2)The full format of the same alongwith the	ended 30th June,2024 (Un-audited) 3.79 10.46 re or -6.67 re or -6.67 re -6.67 en -6.7 en -6.67 en -6.67 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -7.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -7.7 en	months ended 31st March, 2024 (Audited) 8.22 19.99 -11.78 -11.78 -11.78 -11.78 308.94 0 -0.38 Financial Results for t tions & Disclosure Re	Corresponding 3 months ended in the previous year 30th June, 2023 (Un-audited) 1.15 9.95 -8.8 -8.8 -8.8 -8.8 -8.8 -8.8 -8.8 -8.	Year ended 30th March, 2024 (Audited) 26.10 40.92 -14.82 -14.82 -14.82 -14.82 308.94 229.58 -0.48 June, 2024 field with ts, 2015. eindia.com and at the curities Limited SD/-	1 2 3 4 5 6 7 8 8 9	Total Income from operations Other Income Total Income (1+2) Profit before Exceptional Items and Tax Profit before Tax Net Profit for the period Total Comprehensive income for the period Paid-up Equity Share Capital (Face value of Rs. 10/- each per Share) Earnings Per Share (EPS) of Rs. 10/- each (Not Annualised) 1. Basic (Rs.) 2. Diluted (Rs.) tes: The above Un-audited Standalone financial reviewed by the Audit Committee and approv on 12th August, 2024 and the Limited Revie of the Company. The above is an extract of the detailed form ended on 30th June, 2024 filed with the Sto & Disclosure Requirements) Regulations, 2(Results for the Quarter ended on 30th J	Un-audited 170.34 0.35 170.70 6.64 6.64 6.64 - 2,055.50 0.03 0.03 0.03 0.03 0.03 0.03 0.15 the Boar at of Standalou ck Exchange u 015. The full f une, 2024 are	31-03-202 Audited 49. 0. 49. 2. 2. 2. 2. 2. 2. 2. 2. 55. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1.	ded 4 30-0 48 05 53 57 57 81 50 33 33 33 ended 30t ors in their arried out ed Financi tion 33 of e Un-aud on the S om.	J6-2023 audited 42.44 2.31 44.75 1.59 1.59 2,055.50 0.01 0.01 0.01 0.01 1.59 2,055.50 0.01 1.59 1.59 1.59 1.59 1.59 1.59 1.59 1.59 1.50 <t< td=""><td>Year Ended 31-03-2024 Audited 215.93 2.66 218.59 9.69 9.69 280.93 2,055.50 1.37 1.37 1.37 24 have been meetings held sutory Auditors for the Quarter ng Obligations alone Financial ange website: alf of the Board Biztech Limited Sd/-</td></t<>	Year Ended 31-03-2024 Audited 215.93 2.66 218.59 9.69 9.69 280.93 2,055.50 1.37 1.37 1.37 24 have been meetings held sutory Auditors for the Quarter ng Obligations alone Financial ange website: alf of the Board Biztech Limited Sd/-
hìટl સ્લમ ધારાવીના પુનઃવિકાસની યોજના સમયસર પૂર્શ કરવા અંગે અદાશી ગ્રૂપે ખાસ યોજના બનાવી છે. અદાશી ગ્રૂપના ડેરેક્ટર પ્રશવ અદાશી ગ્રૂપના ડેરેક્ટર પ્રશવ અદાશીએ ધારાવીના કાયાકલ્પ કરવાની વેશ્વાસ ધરાવે છે". ૪૯- વર્ષીય ઉદ્યોગપતિ પ્રશવ અદાશીએ કરવાની યોજના અંગે ખાસ માહિતી આપી હતી. અદાશી ગ્રૂપના ચાર ઉત્તરાધિકારીઓ પૈકી એક પ્રશવ અદાશી જૂથના સૌથી મુશ્કેલ પોજે ક્ટ્સનું પૈકી એક ધારાવી દેડેવલપમેન્ટનું સંચાલન કરી રહ્યા છે. ગૌતમ અદાશીની મુંબઈની $ε ૨૦ એકર (૨૫૧ હેક્ટર) પ્રાઇમલેન્ડને એક શાઈનીંગ સીટી હબપાંજના હાલ ચર્ચાના ચગડોળે છે.તેવામાં પ્રશવ અદાશીએ જણાવ્યુંDrinted and Published by MAYUR C. BHATT on behalf of KALYANIPUBLIATION PVT. LTD. and Printed at : Dharti Printers C-3, Shankarઅદાશી જૂથ સાત વર્ષ નાસાંગે ગે બાત મું મું બુધ છે જો ત્યાં ભારા છે.સાં છે તેઓ અમને સંપૂર્ણ સમર્થનસાં છે તે આ અમને જાગ છે.$	No. 1 Total income 2 Total Expenses Net profit / (loss) for the period (before tax, exceptional and / or extraordina: 2 items) Net profit / (loss) for the period before tax (after exceptional and / extraordinary items) Net profit / (loss) for the period after exceptional and / extraordinary items) Total comprehensive income for the period for the period (after tax) 6 Paid up equity share capital 7 Reserve (excluding revaluation reserve gasaic and Diluted Note: (1)The above is an extract of the detailed for Stock Exchange under regulation 33 of the Start (2)The full format of the same alongwith the	ended 30th June,2024 (Un-audited) 3.79 10.46 re or -6.67 re or -6.67 re -6.67 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -6.7 en -7.7 en -6.7 en -7.	months ended 31st March, 2024 (Audited) 8.22 19.99 -11.78 -11.78 -11.78 -11.78 308.94 0 -0.38 Financial Results for t tions & Disclosure Re in the website of stock	Corresponding 3 months ended in the previous year 30th June, 2023 (Un-audited) 1.15 9.95 -8.8 -8.8 -8.8 -8.8 -8.8 -8.8 -8.8 -8.	Year ended 30th March, 2024 (Audited) 26.10 40.92 -14.82 -14.82 -14.82 -14.82 308.94 229.58 -0.48 June, 2024 field with hs, 2015. eindia.com and at the scurities Limited SD/- havna D. Mehta	1 2 3 4 5 6 7 8 9 9	Total Income from operations Other Income Total Income (1+2) Profit before Exceptional Items and Tax Profit before Tax Net Profit for the period Total Comprehensive income for the period Paid-up Equity Share Capital (Face value of Rs. 10/- each per Share) Earnings Per Share (EPS) of Rs. 10/- each (Not Annualised) 1. Basic (Rs.) 2. Diluted (Rs.) tes: The above Un-audited Standalone financial reviewed by the Audit Committee and approv on 12th August, 2024 and the Limited Revie of the Company. The above is an extract of the detailed form ended on 30th June, 2024 filed with the Sto & Disclosure Requirements) Regulations, 2(Results for the Quarter ended on 30th J	Un-audited 170.34 0.35 170.70 6.64 6.64 6.64 - 2,055.50 0.03 0.03 0.03 0.03 0.03 0.03 0.15 the Boar at of Standalou ck Exchange u 015. The full f une, 2024 are	31-03-202 Audited 49. 0. 49. 2. 2. 2. 2. 2. 2. 2. 2. 55. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1. 1.	ded 4 30-0 48 05 53 57 57 81 50 33 33 33 ended 30t ors in their arried out ed Financi tion 33 of e Un-aud on the S om.	J6-2023 audited 42.44 2.31 44.75 1.59 1.59 2,055.50 0.01 0.01 0.01 0.01 1.59 2,055.50 0.01 0.02 by the Stat ial Results f f SEBI (Listi ited Standa Stock Excha and on beha For ECS Vij	Year Ended 31-03-2024 Audited 215.93 2.66 218.59 9.69 9.69 280.93 2,055.50 1.37 1.37 1.37 24 have been meetings held cutory Auditors for the Quarter ng Obligations alone Financial ange website: alf of the Board